

હેત અનંત જ્ઞનનીસમ ડરનારા,  
ભક્તોને હૃદયે વસનારા...

ધ્રઘસ્વરૂપ ગુરુદેવ યોગીજુ ભહારાજને  
૧૩૩મા પ્રાગટ્યમંગલે ભાવભરી વંદના !



# યથાર્થ ગુરુવંદન અને સાથાં ગુરુદર્શન !

**ભારતીય** ઋતુ વ્યવસ્થામાં વૈશાખ અને જેઠ માસમાં સૂર્યદેવ સોળે કળાએ ખીલીને ભારતની ધરતી પર પોતાનાં તેજ, ઊર્જા અને ઉજ્માના તીવ્ર અનુભવ કરાવે છે. સાથે સાથે આ બંને માસમાં અનેક દિવ્ય ઉત્સવો અને સ્મૃતિપર્વો પણ ઉજવાય છે. આ વર્ષે ૧૨મી મે-વૈશાખ સુદ પૂનમે શ્રી બુદ્ધ જયંતી છે, વૈશાખ વદ પાંચમે અનાહિ મહામુક્ત શ્રી ગોપાળાનંદ સ્વામીનો નિર્વાણાદિન છે. વૈશાખ વદની અપરા એકાદશી-૨૩ મેના રોજ બ્રહ્મસ્વરૂપ પરમ પૂજય દરિગ્રસાદ સ્વામીજીની જન્મજયંતી, વૈશાખ વદ બારશ ૨૪ મેના રોજ બ્રહ્મસ્વરૂપ ગુરુદેવ પરમ પૂજય યોગીજ મહારાજની જન્મજયંતી, ૨૮મી મેના રોજ બ્રહ્મસ્વરૂપ પરમ પૂજય પાપાજના મહાનિર્વાણનો શાશ્વત સ્મૃતિદિન, ૧લી જૂનના રોજ ગુણાતીત સમાજની સ્થાપના તથા પરમ પૂજય પાપાજ મહારાજનો સ્વરૂપાનુભૂતિ દિન, જેણે સુદ-દશમે પાંચમી જૂનના રોજ શ્રી સ્વામિનારાયણ ભગવાનના સ્વધામગમનનો શાશ્વત સ્મૃતિદિન, ૧૨મી જૂનના રોજ બ્રહ્મસ્વરૂપ પરમ પૂજય કાકાજ મહારાજનો પ્રાગટ્યદિન અને માણાવદર સ્થિત શ્રી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિરજીના પાટોત્સવ મહાપર્વ સહિત વૈશાખ અને જેઠ માસમાં અનેક વ્રત-ઉત્સવો ઉજવાશે. આ સર્વ ઉત્સવ-પર્વે સૌ દિવ્ય ભગવદ્દ સ્વરૂપોનાં શ્રીચરણે હૃદયના ભાવથી વંદન સાથે સાણંગદંડવત્ત પ્રણામ ધરીએ છીએ, અને તેઓનીકુપાશિખની યાચના કરીએ છીએ.

આ વર્ષે વૈશાખ સુદ ચતુર્થીજે બ્રહ્મસ્વરૂપ શ્રી શાસ્કીજ મહારાજના મહાનિર્વાણની શાશ્વત સ્વસ્તિતિથિદાતી, તેજ દિવસે ૧લી મેના રોજ નવી મુંબઈના ખારઘર સ્થિત અનુપમ ભિશનના ઉપાસના ધામમાં પ્રગટ શ્રી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિરજીમાં બિરાજમાન શ્રી મુક્ત અક્ષરપુરુષોત્તમ મહારાજ, સર્વ દેવતાઓ તથા ગુણાતીત સંત સ્વરૂપોની દિવ્ય મૂર્તિઓનો ૧૮મો પાટોત્સવ પણ અત્યંત ભક્તિભાવ સહિત ઉજવાયો. આ પાટોત્સવ મહાપર્વની ઉજવણી દરમિયાન સહ્ય પૂજય અશ્વિનાદાના પ્રત્યક્ષ સાંનિદ્યમાં સૌ સંતો અને ભક્તોને સ્વયં પ્રગટ ગુરુદરિ સંતભગવંત સાહેબજીની દિવ્ય ઉપરથિત તથા આશીર્વાદના અનુભવ થયા. ‘બ્રહ્મનિર્જર’નો આ અંક આપની અમીનજર હેઠળ દુશે ત્યારે સુરત સ્થિત અનુપમ ભિશનના ઉપાસના ધામમાં પ્રગટ મંદિરજીમાં બિરાજમાન શ્રી મુક્ત અક્ષરપુરુષોત્તમ મહારાજ, સર્વ દેવતાઓ તથા ગુણાતીત સંત સ્વરૂપોની દિવ્ય મૂર્તિઓનો ૧૮મો પાટોત્સવ પણ તેવીજ દિવ્યતાસભર ભક્તિ, સેવા, સત્યંગ અને પરમ આનંદ સાથે ઉજવાયો દુશે.



મે માસમાં એક વિશિષ્ટ અને આધ્યાત્મિક ઉત્કાંતિના શુભાર્થનો દિવસ પણ આવે છે. આ દિવસ છે ૧૪મી મે ! આજથી પછી વર્ષ પહેલાં - ૧૪મી મે ૧૯૬૬ના મહા મંગલકારી દિવસે વહેલી સવારે બ્રાહ્મમુહૂર્તના સમયે અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં સ્થિત શ્રી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિરજીના પ્રાંગણમાં બ્રહ્મસ્વરૂપ ગુરુદેવ યોગીજી મહારાજે પોતાની નાનકડી ઓરડીમાં ૨૫ વર્ષના યુવાન એવા પોતાના અત્યંત વહાલા શિષ્ય જશભાઈ (સાહેબજી)ને પોતાના પરમ દિવ્ય અમૃતપ્રેમમાં તરબોળ કરી આજ્ઞારૂપી મંત્રદીક્ષા આપી ! બ્રહ્મસ્વરૂપ ગુરુદેવ પરમ પૂજય યોગીજી મહારાજે કહ્યું, ‘સંસારમાં જશો નહીં, તમોને બધાને સાધુ બનાવવા છે ; પરંતુ, ભગવાં લૂગડાં નથી આપવાં, આનાં આ લૂગડે સાધુ બનાવવા છે. તમારાં સૌનાં હદ્યભગવાં કરવાં છે !’

હજરો વર્ષોના વિશ્વના આધ્યાત્મિક ઈતિહાસમાં ભગવાનના તત્ત્વના ધારક કોઈ ગુણાતીત સાધુએ પોતાના શિષ્યને ભગવા હદ્યના સાધુની દીક્ષા આપી દોયતેવી ઘટનાની જાણ નથી. કેવળ પાંચ વાક્યો બોલી સનાતન ભારતીય આધ્યાત્મિક પરંપરામાં સંન્યાસ આશ્રમનો એક નવો માર્ગ ચીંધી બ્રહ્મસ્વરૂપ ગુરુદેવ યોગીજી મહારાજે સાહેબજીને આ માર્ગના જ્યોતિર્ધર બનાવ્યા, એટલું જ નહીં પરંતુ, તે પૂર્વે પત્રમાં લખીને આશીર્વાદ આપી સાહેબજીના દિવ્યસ્વરૂપનાં પણ સૌને દર્શન કરાવ્યાં. જુલાઈ ૧૯૬૪માં લખેલા એક પત્રમાં બ્રહ્મસ્વરૂપ ગુરુદેવ યોગીજી મહારાજે સ્વહસ્તે લખ્યું,

## દ જીજુના પ્રાર્થના દર્શન તો હોલે લાગ્યે નાયા

“(હે જશુભાઈ તમો સ્વામીના લાડીલા છો તો જે ધારશો તે થશે...)”.

બ્રહ્મસ્વરૂપ ગુરુદેવ યોગીજી મહારાજના આશીર્વાદનો દરેક શર્ષદ એક નહીં, અનેકવાર સાકાર થયો છે. પછી તે નવી મુંબદી સ્થિત ખારધરમાં પ્રગટ શ્રી ઠાકોરજી મહારાજના મંદિરજીનું અસંભવ જણાતું નિર્માણ હોય, કે, સુરત સ્થિત શ્રી ઠાકોરજી મહારાજના મંદિરજીના પૂજારી સેવક સાધુ પૂ. કાનજીદાસજીના જીવનનાં અશક્ય જણાતાં દિવ્ય પરિવર્તન હોય. આ અને આવાં અનેક માનવીય શક્તિ અને સમજની દણિએ અસંભવ કાર્યો બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજના આશીર્વાદના પ્રતાપે પ્રગટ ગુરુહરિ સંતભગવંત સાહેબજીના સંકલ્પ-પ્રાર્થનાની શક્તિ અને પ્રભુનાં ઐશ્વર્ય-પ્રતાપી સંભવ થયાં છે. આપણાં સર્વ મંદિરજીનાં પાટોત્સવ મહાપર્વોના વિશેષ પ્રસંગોએ હવે સમય આવ્યો છે કે આજની ઊછરતી પેઢીને બ્રહ્મસ્વરૂપો ગુરુહરિ શાક્ષીજી મહારાજ અને યોગીજી મહારાજનાં દિવ્ય કાર્યોની અને પ્રગટ ગુરુહરિ સંતભગવંત સાહેબજી દ્વારા જે અલોકિક અને અદ્ભુત રીતે ગુરુદેવનાં એ દિવ્ય કાર્યો વહેતાં રહ્યાં છે તેના પ્રેરણાદાયી ઈતિહાસની જાંખી કરાવીએ અને આ જાંખીનાં દર્શન દ્વારા શ્રી સ્વામિનારાયણ ભગવાન, અનાદિ અક્ષરબ્રત શ્રી ગુણાતીતાનંદ સ્વામી અને શ્રી અક્ષરપુરુષોત્તમ ઉપાસનાના વૈજ્ઞાનિક સનાતન આધ્યાત્મિક માર્ગના મહિમાના પણ પરિચય કરાવીએ.

પ્રાર્થનાછે : હે પ્રભુ ! હે સર્વ ગુણાતીત સંતસ્વરૂપો ! હે પ્રગટ ગુરુહરિ સંતભગવંત સાહેબદા ! શ્રી ગુરુઆજ્ઞા મહિમા પર્વના આ વર્ષ આપની જ કૃપાથી આપના યથાર્થ સ્વરૂપ ઓળખી, આપનો યથાર્થ મહિમા સમજ આપની આજ્ઞાને પ્રામાણિકપણે યથાર્થરૂપે અમારાં જીવનાચરણ બનાવીએ અને તે દ્વારા જે વંદન અર્પણ કરીએ, આપનાં જે દર્શન કરીએ તે જ યથાર્થ ગુરુવંદન અને સાચાં ગુરુદર્શન ગણાશે.

~ મનો. મનો. ~ સાધુ મનોજદાસ



## સંતલગ્વંત સાહેબજીની શ્રી માહાવ્યક્તસભાર વાહી સદા...

શ્રી વચનામૃત ગઢા પ્રથમ પદ : 'અસાધારણ સ્નેહનું' નું નિર્દ્દિપણ  
૮ માર્ચ ૨૦૨૪, 'અક્ષરમહોલ', તપોભૂમિ બ્રહ્મજ્યોતિ, મોગરી

નિશ્ચય ? તો વિશ્વાસ થાયકે, આજ મારા કલ્યાણદાતા છે, એમના આધારે  
જ મારું જીવન છે અને તેઓ જ મને સુખી કરશે; એવો વિશ્વાસ હોય તો  
એમના માટે પ્રેમ અંદરથી છૂટે.

ધાણા છોકરાઓ સચિન તેંડુલકરને મળ્યા પણ નથી, તો પણ  
તેંડુલકરનો શોટો રૂમમાં રાખે. એ આવીને ખબર પણ ના પૂછે કે, 'તમે કેમ  
છો ? મજામાં છો ?' અને જો પૂછે તો તમે ખુશ થઈ જાવકે અધ્યર ચાલો,  
ઓછો, તેંડુલકરે મારી ખબર પૂછી ! તેંડુલકરને પણ ખબર નહીં હોય કે,  
તમે એનો શોટો રાખો છો કે તમે કોણ છો ? તો ય એના માટે તમને પ્રેમ છે  
તો એનો શોટો રાખો છો. એની વાત કરવાનું કહીએ તો તેણે કેટલી સદી  
મારી ને કેટલા બોલરોની બોલિંગ છોડાવી દીધી તેનાં ધડાધડ બધાં  
સ્ટેટિસ્ટિક્સ આપવા માંડીએ. એના પર એક વિશ્વાસ છે કે, એ બહુ  
જવાબદારીપૂર્વક રમનાર છે, કિકેટની રમતને સમર્પિત થયેલો છે, કિકેટ  
દ્વારા દેશનું નામ વિશ્વમાં રોશન કર્યું છે અને ગમે તેવી પરિસ્થિતિમાં, ગમે  
તેવા સંજોગોમાં પણ એ બેટિંગ કરવા આવે તો સામી ટીમ એની ઉપર હાવી  
ના થઈ જાય એવી અદ્ભુત એનામાં ટેક્નિક છે. એની રમત ઉપર માણસને  
વિશ્વાસ છે અને એ વિશ્વાસને લઈને એના પર પ્રેમ પ્રગતે છે. એમ,  
સત્પુરુષમાં વિશ્વાસ હોય, ભગવાનમાં વિશ્વાસ હોય તો એક વિશ્વાસો કરીને  
એમના માટે પ્રેમ ઉભરાય.

અને બીજું, માણાત્મ્ય સહિત નિશ્ચય ! તેઓ સર્વોપરી છે, સર્વ  
અવતારના અવતારી છે, સર્વના કારણ છે એવું એમનું અપરંપાર  
માણાત્મ્ય ! તેઓ કેવા મોટા છે અને મને મુખોમુખ મળ્યા ! એવા પ્રભુનો  
મને આશરો થયો ! એવું માણાત્મ્ય હોય તો આપોઆપ એમના પર હેત  
ઉભરાય, હેત થાય ! ને વિશ્વાસ હોય કે, તેઓ મારા કલ્યાણદાતા છે.

એમના આશરે કરીને, એમના થકી જ મારું કલ્યાણ છે એવો દઢ વિશ્વાસ હોય તો એમની સાથે અસાધારણ હેત થાય. વિશ્વાસ અને માણાત્મ્યયુક્ત નિશ્ચય-એ બે હોય તો ભક્તને અસાધારણ હેત પ્રગટે છે.

શ્રી કૃષ્ણ ભગવાન આમ ગોવાળિયા જ કહેવાતા, પણ એ ગોવાળિયા નથી. ભલે ગાયો ચરાવે છે, આપણી સાથે ડંગોરો લઈને ફરે છે, આપણે જેમ ગાયોને બુચકારીએ છીએ એમ ગાયોને બુચકારે છે; પણ એ સ્વયં પ્રભુ છે. એમના આશરે રહેવાથી આપણું કલ્યાણ થશે. એમની સ્મૃતિથી આપણો ભાવ બદલાશે; એવું માણાત્મ્ય ગોપીઓને હતું તો શ્રી કૃષ્ણ ભગવાનની સ્મૃતિ કરવાથી ગોપીઓ બદલાઈ ગઈ. એટલે એક વિશ્વાસ, બીજું માણાત્મ્ય સહિત નિશ્ચય. નિશ્ચય હોય છે પણ માણાત્મ્ય નથી હોતું એટલે ઢીલા પડી જવાય છે. માણાત્મ્ય નથી એનું કારણ? સ્વાધ્યાય નથી, કથાવાર્તા નથી. જે લોકો કથાવાર્તામાં રેઝ્યુલર આવે છે, બેસે છે, ‘વચ્ચનામૃત’ વાંચે છે, ‘સ્વામીની વાતો’ વાંચે છે એને માણાત્મ્ય અંદરથી વધતું જ જશે, જ્યાલ નહીં આવે પણ માણાત્મ્ય વધશે. સેવાઓ બહુકરીએ પણ જો માણાત્મ્ય ના હોય તો એ સેવાઓ કંટાળાજનક બની જાય. સેવાઓ અહંકાર પણ વધારી હે. સેવાઓ અગડાનું કારણ પણ બની જાય. પણ જો માણાત્મ્ય હોય તો એ સેવા દાસત્વભક્તિ વધારે ને તો ભગવાનની પ્રસત્તા ગ્રામ થતાં આપણા દેહનો ભાવ ઓગણતો જાય.

પછી વળી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, ‘એવો ભગવાનનો મહિમા પણ જાણતો હોય અને અસાધારણ હેત ન થાય તેનું શું કારણ છે?’ પછી શ્રીજમહારાજ બોલ્યા જે, ‘જો એ ભગવાનનો આવો મહિમા જાણો છે તો એને ભગવાનને વિશે અસાધારણ હેત છે પણ એ જાણતો નથી. જેમ દનુમાનજીમાં અપાર બળ હતું પણ કોઈકના જાણાયા વિના જણાયું નહીં. અને જેમ પ્રલંબાસુર બળદેવજીને લઈ ચાચ્યો ત્યારે પોતામાં બળ તો અપાર હતું પણ પોતે જાણતા ન હતા. પછી જ્યારે આકાશવાણીએ કહ્યું ત્યારે જાણ્યું. તેવી રીતે એ ભક્તને ભગવાનને વિશે અસાધારણ પ્રીતિ તો છે પણ જણાતી નથી.’

‘એને માણાત્મ્ય હોય તો પણ હેત ના હોય એનું કારણ શું છે?’ મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો. આપણાને બધાને હેત છે એટલે તો આવ્યા છીએ, પણ ઘણાંનું જણાતું નથી અને ઘણાંનું જણાય છે—એ પોતાના અંગ ઉપર આધાર રાખે છે. જેને પ્રીતિનું—પ્રેમનું અંગ હોય એનું હેત દેખાય. આંસુડાં પાડે, ખોયા ખોયા કરે. પણ, સમજણવાળો હોય—બુદ્ધિપ્રદાન હોય એને માણાત્મ્ય હોય પણ દેખાય નહીં. અને સેવકો—દાસત્વભક્તિથી સેવા કર્યા કરતા હોય, તો તેઓ સેવા શાથી કરતા હોય? અસાધારણ હેત છે એટલે કરે છે.

દનુમાનજીનો દાખલો આપ્યો. દનુમાનજી સીતાજીને શોધવા માટે ગયા. રામેશ્વરમ્ભ પાસે ધનુષકોડી પદ્ધોંચાયા. લંકા જવાનું હતું, તે દરિયો જોઈને બધાને થયું કે કેવી રીતે જઈશું? સાથે જાંબુવાન હતા. તેમણે દનુમાનજીને કહ્યું કે, ‘તમે નાના હતા ત્યારે કેકડો મારીને સૂર્યને પકડવા ગયા હતા.’ એમની જે તાકાત હતી એનું જાંબુવાને દર્શન કરાયું. તો શ્રી રામનું નામ વર્ધ દનુમાનજીએ ‘દ્ર્યુ’ કરીને કુદ્ધો માર્યો તો પદ્ધોંચી ગયા સીધા લંકામાં. એમ, આપણામાં ભાવ છે, ભક્તિ છે. આપણા સંતો એમ ને એમ સંસાર છોડીને બેઠા છે? ભગવાનનું અસાધારણ હેત હોય તો જ સંસાર છૂટે, નહીં તો સંસાર કેવી રીતે છોડે? માણસ વ્યસન નથી છોડી શકતા, ખાવા-પીવાનું, દરવા-દ્રવાનું નથી છોડી શકતા તો સંસાર કેમનો છોડે? જુવાનજીએ દીકરાઓને સંસાર શાથી છૂટી ગયો? તો એવું ભગવાનમાં અસાધારણ હેત હોય તો છૂટે. પોતાનું દાસત્વભક્તિ-વિશ્વાસનું અંગ હોય, બુદ્ધિપ્રદાન-સમજણાંનું અંગ હોય એ બેને જ્યાલ ના પડે. પ્રીતિવાળાને ખબર પડે, એ ભગવાન વગર સોરાય. જેને અસાધારણ પ્રેમ હોય એને દર્શનના થાય તો સોરાય, એટલે જ્યાલ આવે કે એને દર્શનની તાણ છે. પેલા બેને જ્યાલ ના આવે, પણ અસાધારણ હેત છે જ એવું મહારાજનું કહેવું છે. આપણાને બધાને ભગવાનને વિશે હેત છે એટલે તો આપણે અહીં બેઠા છીએ.

પોતાના આત્મભાને  
સત્પુરુષ સાથે જોડી દેવો,  
સ્મૃતિમાં રહેવું અને માણાત્મ્યના વિચારમાં રહેવું.  
એ માણું જે આજ્ઞા આપી હોય  
એ પ્રમાણું જીવન જીવવું.



પછી વળી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, ‘એ પ્રીતિના બળને જણાયાનું શું કારણ છે ?’ પછી શ્રીજમહારાજ બોલ્યા જે, ‘સત્સંગ અને સત્થાશ્ચનું શ્વરણ કરતે સતે અને ભગવાનને વિષે અસાધારણ પ્રીતિ છે તે જણાઈ આવે છે.’

પછી વળી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, ‘દેશ, કાળ અને કિયા તે ભૂંડાં થાય અથવા ભલાં થાય તેનું કારણ તે સંગ છે કે કોઈ બીજો છે ?’ પછી શ્રીજમહારાજ બોલ્યા જે, ‘દેશ તો પૃથ્વી કહેવાય તે સર્વ ડેકાણો સરખો છે અને કાળ પણ સરખો છે, પણ અતિથય જે મોટા સમર્થ પુરુષ હોય તે જે દેશમાં રહેતા હોય તેને પ્રતાપે કરીને ભૂંડો દેશ હોય, ભૂંડો કાળ હોય, ભૂંડી કિયા હોય તે સર્વે સારાં થઈ જાય છે ; અને અતિથય ભૂંડાં પાપી પુરુષ જે દેશમાં રહેતા હોય તેને યોગે કરીને સારો દેશ ને સારી કિયા ને સારો કાળ હોય તે પણ ભૂંડાં થઈ જાય છે. માટે શુભ ને અશુભ એવાં જે દેશ, કાળ ને કિયા તેના હેતુ તો પુરુષ છે. તે પુરુષ જો અતિથય સમર્થ હોય તો સર્વ પૃથ્વીમાં દેશ, કાળ ને કિયા તે પોતાના સ્વભાવ પ્રમાણો પ્રવર્તાવે ને તેથી ઉત્તરતો હોય તો એક દેશમાં પ્રવર્તાવે ને તેથી ઉત્તરતો હોય તો એક ફળી તથા એક પોતાનું ઘર તેમાં પ્રવર્તાવે. એવી રીતે એ શુભ-અશુભ જે દેશ, કાળ ને કિયા તેના હેતુ તો શુભ ને અશુભ એબે પ્રકારના પુરુષ છે.’

જોયું, સત્સંગ અને કથાવાતરિનું વસન રાખે તો પ્રીતિનું બળ જણાઈ આવે. મોટા પુરુષની સ્મૃતિમાં રહીએ પણ દેશ, કાળ, કિયા ને સંગ અની અસર થાય જ. કોરાના વખત હતો ત્યારે રોગ જ એવો હતો, કે એણે આખી દુનિયાને આવરી લીધી. પણ છતાં આઈસોલેશનમાં રહે, કોઈના સંસર્ગમાં ના આવે તો એનાથી બાખ્ય રીતે-દિઝિકલ બોડીની રક્ષા થાય. પણ જ્યારે આંતરિક વાતાવરણ એવું હોય અને આપણાને અંદર કંઈ થાય ત્યારે એકાંતમાં ચાલ્યા જવું. એકાંતમાં શું ? તો પોતાના આત્માને સત્પુરુષ સાથે જોડી દેવો, સ્મૃતિમાં રહેવું અને માણાત્મ્યના વિચારમાં

સત્પુરુષની સ્મૃતિ કરીએ,  
ધૂન, ભજન ને પ્રાર્થના કરતા રહીએ અને  
એમની આજ્ઞા પ્રમાણે જીવન જીવીએ તો  
ગમે એવો દેશ, કાળ, કિયા ને સંગ હશે,  
પણ આપણાને ડિસ્ટર્બ કરી શકશે નહીં.

રહેવું. અથવા તો એમાણે જે આજ્ઞા આપી હોય એ પ્રમાણે જીવન જીવવું. તો પછી એ અસર નહીં કરે એમ ભગવાનનું કહેવું છે.

આપણા દેશમાંથી જે યુવાનો વિદેશ ગયા તેમને બાપાએ કહ્યું, ‘પૂજા કરવા મૂર્તિઓ લઈ જવ.’ તેમને માળા-કંઠી પહેરાવી અને ધૂનનો નિયમ આપ્યો, અધવાડિક સત્સંગસભાનો નિયમ આપ્યો. ‘વચનમૂત્ત’માં શ્રી સ્વામિનારાયણ ભગવાને કહ્યું, ‘આજ્ઞા પણે તો એની ભેણી ભગવાનની મૂર્તિ આવે.’ જે યુવાનો આજ્ઞા પણીને જીવન જીવ્યા એમના ભેણી ભગવાનની મૂર્તિ રહી તો અમેરિકાની અસર ના થઈ, જ્યાલ આવ્યો !? સર્વાગ સુંદર એમનું જીવન બન્યું ને ત્યાં સત્સંગના પાતાળે પાયા નાખ્યા. બાકી તો બધા એમ કહેતા કે, અમેરિકા દેશ એવો છે કે ગમે તેવો સારો છોકરો પણ એના પ્રવાહમાં ખેંચાઈ જાય, પણ આ યુવાનો ત્યાં ખેંચાયા નહીં, ઉલ્લો ત્યાંનો પ્રવાહ બદલી નાખ્યો એટલા તાકાતવાળા નીકલ્યા. આવું ક્યારે રહેવાયું ? તો યોગીજ મહારાજ જેવા સત્પુરુષની આજ્ઞા પણીને જીવા તેથી આવું રહી શક્યા. એમ, ગમે ત્યાં જઈએ, ગમે એવો દેશ હોય, ગમે એવો વિપરીત કાળ હોય પણ સત્પુરુષની સ્મૃતિ કરીએ, ધૂન, ભજન ને પ્રાર્થના કરતા રહીએ અને એમની આજ્ઞા પ્રમાણે જીવન જીવીએ તો ગમે એવો દેશ, કાળ, કિયા ને સંગ હશે, પણ આપણાને ડિસ્ટર્બ કરી શકશે નહીં.

‘એક રાધા એક મીરાં દોનોં ને શ્યામ કો ચાહાએ...’ રાધાનો પ્રેમ અસાધારણ પ્રેમ કહેવાય. દાઢુકાકા કહેતા, ‘બધા શ્રીકૃષ્ણને સંભારે, પણ શ્રીકૃષ્ણ રાધાને સંભારે.’ ધાર્ણા દલીલ કરે કે, રાધાને આટલો બધો પ્રેમ હતો, શ્રીકૃષ્ણ ને રાધાની આટલી બધી વાતો થાય છે પણ ‘શ્રીમદ્ ભાગવત’માં કોઈ જયાએ રાધાનું નામ નથી, ઉદ્દેખ જ નથી. આટલા બધા પ્રેમમાં રાધા હોય તો એનો ઉદ્દેખ તો હોવો જોઈએને ? ત્યારે સંતો અને દાર્શનિકો એનો જવાબ આપે છે કે, રાધા શ્રીકૃષ્ણમય થઈ ગઈ હતી, ભગવાનમાં વિસર્જિત થઈ ગઈ હતી એટલે એનું પોતાનું કોઈ અસ્તિત્વ નહીંતું અને જેનું અસ્તિત્વ ના હોય એનું તમે કેવી રીતે લખાણ લખો ? સામે મીરાં ! મીરાં પણ પ્રેમમાં એટલી બધી તરબોળ થઈ ગઈ, તો એવું

કહેવાય છે કે છેલ્લે મીરાં શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિમાં સમાઈ ગઈ. રાધા અને મીરાં બંને ભગવાનમાં રસડ્રપ હતાં.

એમ, આપણે મૂળ અક્ષરબ્રત ગુણાતીતાનંદ સ્વામીની વાત કરીએ તો, ૧૦૦ પરમહંસો, ૨૦૦૦ સાધુઓમાં મહારાજે કહ્યું, ‘ગુણાતીત દ્વારા હું પ્રગટ રહીશ.’ પણ ‘વચનામૃત’ તમે વાંચો, એમાં કોઈ જ્યાએ ગુણાતીતનું નામ મહારાજે લીધું નથી. તો બધા કહેને કે, તમે આવું ક્યાંથી શોધી કાઢ્યું ? ‘વચનામૃત’માં મુક્તાનંદ સ્વામી, નિષ્ઠુળાનંદ સ્વામી, બ્રતાનંદ સ્વામી આદિ પરમહંસોનાં નામ છે. પણ જેને તમે ગુણાતીત-ગુણાતીત કરો છો એમનું તો એક હિવસેય મહારાજ નામ પણ નથી બોલ્યા! ત્યારે એમને સામે એવું કહેવાય કે, ગુણાતીત મહારાજમાં વિસર્જિત થઈ ગયા હતા. ગુણાતીતનું પોતાનું કોઈ અસ્તિત્વ નહોતું. એ મહારાજડ્રપ થઈ ગયેલા એટલે એમનું જુદું કંઈ છે નહીં. એવો અસાધારણ પ્રેમકે જે માં પોતાનો ભાવ છૂટી જાય.


એવું બીજું એક મીરાંબાઈનું ભજન છે - ‘જો તુમ તોડો પિયા, મેં નહીં તોડું રે, તોરી પ્રીત તોડી કિઝા કોન સંગ જોડું ?’ અસાધારણ પ્રેમ એ કે, ભગવાન તમે મને છટકારણો, કાઢી મૂક્શો, ‘જા તારું મોહું મને ના બતાડીશ.’ ‘ભગવાન તમે મને એવું કહેશો તો પણ હું તમારી સાથેનો પ્રેમ નહીં તોડી શકું. કારણકે, તમારી સાથેનો નાતો તોડીને જગતનું એવું કોઈ છે નહીં કે જે ની સાથે હું જોડાઉં.’ આ ભગવાનનું માદાત્મ્ય છે ! તો ભક્તે ભગવાનની ભક્તિ છોડી બીજે જવું નહીં. તમે જ એક ભગવાન છો, જે મને આધારે કલ્યાણ છે, જે મને આશરે, જે મની ભક્તિથી સુખ, શાંતિ ને આનંદ મળે છે - એવું અસાધારણ માદાત્મ્ય હેતુનું કારણ છે; મહારાજે એ બતાવ્યું. મીરાંબાઈનું આ ભજન સરસ છે, ભક્તિ મીરાંએ શિખવાડી.

ધારા વાત કરતા હોય છે કે, આ લોકમાં લોકો આવું કહે છે ને લોકો પેલું કહે છે. મહારાજ કહે, ‘જોવાજેવાતો એક ભગવાન છે.’ ભગવાન શું કહે છે એ વિચારો, લોકો શું કહે છે એ ના વિચારો. યોગીજી મહારાજ અમને યુવાનોને ને સંતોને કહેતા કે, ‘આપણો જન્મ તો ભગવાન ને

સત્પુરુષને રાજુ કરવા માટે થયો છે.’ બીજાનો જન્મ જે ને માટે થયો હોય, એ એ જાણો, પણ આપણો જન્મ તો એક ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાનને ને ગુરુ યોગીજી મહારાજને રાજુ કરવા થયો છે. તો તેઓ રાજુ થાય એનું અનુસંધાન રાખીને જીવન જીવીએ. સામાન્ય રીતે આખી દુનિયા - ૬ અબજની વસ્તી સમાજને અનુલક્ષીને જ જીવન જીવે છે. એટલે કે તિલક-ચાંદ્લો કરીશું તો લોકો શું કહેશે ? સાધુ-સંતો સાથે પદ્ધરામણીએ ફીરીશું તો સમાજમાં કેવા દેખાઈશું ? સત્યસંગના સારા સંસ્કારોને કારણે સમાજના કુરિવાજો કે અંધશ્વર્વાળા કાર્યક્રમોમાં હાજરી નહીં આપીએ તો સમાજમાં રહેવામાં આપણને તકલીફ પડશે. વગેરે વગેરે. પણ સમાજમાં તો તમે સારું કરશો તો પણ અને ખોટું કરશો તો પણ ટીકા જ થવાની છે. તમે જે કરો એની ટીકા કરવી એ લોક. અને એવા લોકને જોઈને ૮૮.૮૮% માણસો દુઃખી થાય છે કે, લોકમાં શું કહેશે ? લોક કેમ કહેશે ? અને એના આધારે પોતાનો આખો વ્યવહાર કરતા હોય છે. એટલે માણસો દુખિયાં છે.

ભગવાનનો ભક્ત એનાથી જુદો પડે છે કે, મારા ગુરુ શું કહે છે, મારા ઈષ્ટદેવ શું કહે છે ? અનું અનુસંધાન રાખીને જીવન જીવે તો લોક એને વશ થઈ જાય. માણસો લોકને વશ થઈને જીવે છે એટલે દુઃખી થાય છે. પ્રભુને વશ થઈને જીવે તો લોક એને વશ થઈ જાય, સુખી થઈ જાય. મીરાંબાઈ, નરસિંહ મહેતા ને આ બધા સંતો એવું જીવ્યાં તો સુખિયા થઈ ગયાં એટલે આપણો એમને યાદ કરીએ છીએ. પરમહંસો, સંતો, યોગીજી મહારાજને આશ્રિત બધા ભક્તો, આપણે બધા સંતો-ભક્તો એક ભગવાન અને ગુરુ તરફ જોઈને જીવન જીવીએ છીએ. એટલે ભગવાન તરફ જોઈને, પોતાના ગુરુની આજ્ઞાથી જે જીવન જીવે છે એ જ સાચું જીવન જીવે છે. મહારાજે કહ્યું, અસાધારણ દેત હોય તો એમને રાજુ કરવાનો દૈયામાં ભાવ જાગે. રાજુ કરવાનો ભાવ જાગે તો એમનું ગમતું જ રહે અને એમને ન ગમે એ શૂટું જાય; તો આપો આપ સુખિયાં થતાં જઈએ.

સહજાનંદ સ્વામી મહારાજની જાય !



આપણો જન્મ તો એક ઈષ્ટદેવ  
શ્રી સ્વામિનારાયણ ભગવાનને ને  
ગુરુ યોગીજી મહારાજને રાજુ કરવા થયો છે.  
તો તેઓ રાજુ થાય એનું  
અનુસંધાન રાખીને જીવન જીવીએ.



स्वामीश्रीजी



# સાધુ હંદ્યની પ્રાર્થનાગંગા

હે બ્રહ્મસ્વરૂપ કાકાજી મહારાજ !

આપે તેજપુંજ... ઉપાસનાનો

પ્રત્યક્ષપ્રગટને સ્વીકારી

યોગીબાપાને ધારી

રોમરોમ પદ્મરાવી

જીવન સમર્પી

સૌનાં હૈયે સ્થાપી

સ્વામી શ્રીજીને રાજ કરી

સમગ્રે હિંદ્યતા પ્રસારી

શાશ્વત સ્થાપી

હિંગંતે ગુંજતીકરી.

હે દ્યાળુ !

આપ અમારા

યોગી અમારા

યોગીરૂપ સાહેબજી અમારા

તે આપે દઢ કરાવ્યું.

હવે

અમે સ્વામી શ્રીજીના

યોગીના... સાહેબના

તે ધબડારે

જીવતા કર્યા

તે ધબડાર

શાશ્વત કરો !

સ્થિર કરો !

આપના પ્રાગટ્ય મંગલે

આપનાં સર્વ ભૂલકાંઓની આ પ્રાર્થના છે !

હે બ્રહ્મસ્વરૂપ હરિપ્રસાદ સ્વામીજી મહારાજ !

આપ શ્રીજીસ્વરૂપમાં એકાકાર, અદૈતભાવે નિર્ગુણભાવ !

શ્રીજી પરબ્રહ્મ પુરુષોત્તમ અને અનાદિ અક્ષરબ્રહ્મ

બંને દેહથી જુદા; છતાં, અક્ષરપુરુષોત્તમ સ્વરૂપે એક !

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજમાં શ્રી અક્ષરપુરુષોત્તમ પ્રગટ

તે શાશ્વત સત્યનો સ્વીકાર કર્યો

તેના ચરણે સમર્પણ ધર્યા !

તેઓને પ્રસત્ર કરવા જવે

તે રૂપાંતરણને પામે

‘સ્વ’ ઓગળી જાય

બ્રહ્મસ્વરૂપ સ્થિતિ પામે

તેમાં પરબ્રહ્મ વિલસે

પારસથી પારસ બને

હે દ્યાળુ, હે સ્વામી !

આ સિદ્ધાંત

આજે બ્રહ્મસ્વરૂપ ગુરુહરિ શાસ્વતી મહારાજ,

ગુરુદેવ યોગીજી મહારાજની કૃપા

તથા આપના અને બ્રહ્મસ્વરૂપો પરમ પૂજ્ય કાકાજી,

પરમ પૂજ્ય પપ્પાજીનાં જતન પ્રાર્થના અને આશીર્વાદથી

અનેક આત્માના અંતરે સ્થિર થયો.

સૌ ધન્ય થઈ ગયા, ન્યાલ થઈ ગયા.

આપના પ્રાગટ્ય મંગલે

આપને વંદન... અહોભાવ ધરીએ

અમને સાહેબજી સ્વરૂપમાં

શ્રી અક્ષરપુરુષોત્તમના તત્ત્વ સાક્ષાત્ મખ્યા છે.

સાહેબજીએ અમને દીક્ષિત કર્યા છે, સ્વીકાર્યા છે.

હવે સંકલ્પ છે, ગદ્ગદભાવે પ્રાર્થના છે ...

શ્રી અક્ષરપુરુષોત્તમના પ્રગટ સ્વરૂપ અમને પ્રામ

પ્રત્યક્ષ ગુરુહરિને રાજ કરવા,

આપના હિંય કાર્યના વાહક બની રહીએ તે અભ્યર્થના !

સાધુ રાજાદાસના જય સ્વામિનારાચલા.



# અનુપમની હે અમૃતદારો...!

~ સદગુરુ સાધુ પરગ પૂજય અશ્વિનદાદા

યુવા સભા, ઉપાસના ધાર્મ, અમદાવાદ

૧૧ એપ્રિલ ૨૦૨૫

જેને આપણે પ્રાથમિક શિક્ષણ કે કેળવણી કહીએ છીએ, એના માટે બે શરૂઆતનું માધ્યમ છે : એક સુટેવ અને બીજું વિવેક. સત્સંગનો આ પાયો છે. આપણે પ્રાર્થનામાં તો ‘ઉચ્છ્વાસે, નિઃશ્વાસે, મારી એક જ રટણા હો !’ અને બીજું, ‘આતમ તારા મહિમા કેરો કરી ના પામું પાર...’ બહુ ઊંચી આધ્યાત્મિક માગણી કરી. આપણે વાતો મોટી છે, એને જુદી રીતે કહીએ તો આપણું લક્ષ્ય બહુ ઊંચું છે. અને ઊંચા લક્ષ્ય ઉપર પહોંચવું હોય તો આપણો પાયો મજબૂત હોવો જોઈએ. ૧૦૨ માણની ઈમારત જોવા માટે આપણે દુબઈ જઈએ છીએ ને એની ઊંચાઈ જોઈને ખુશ થઈએ છીએ, પણ એની પાછળ સ્ટ્રક્ચરલ ઓન્જિનિયરે એના પાતાળે પાયા નાખ્યા હોય છે. શાલીજ મહારાજે શ્રી અક્ષરપુરુષોત્તમ ઉપાસનાના સિદ્ધાંતના પાતાળે પાયા નાખ્યા, તો આજે વર્તમાનકાળે આપણે આપણા સત્સંગની વિશ્વબ્યાપી સુવાસ જોઈ શકીએ છીએ. એની પાછળ આપણી આગલી પેઢીઓમાં થઈ ગયેલા સંતો અને ભક્તોની જબરજસ્ત તપશ્ચર્યાનું પરિણામ છે.

ગુણાતીતાનંદ સ્વામીએ એક વાતમાં આધ્યાત્મિક બાબત સમજાવી છે કે, ‘અંતર ધરી ન જાય અને ટાકું રહે એના બે ઉપાય છે. એમાં પહેલી વાત કે, ભગવાનનું નિરંતર ભજન કરવું અને બીજું ભગવાન જે કરતા હશે તે સારું કરતા હશે. કારણ કે, દાસના દુષ્મન હરિ કોઈ દી’ હોય નહીં.’ આ આપણા સત્સંગનો પાયો છે, જેને આપણે કર્તાહીતિપણાનો પાયો કહીએ છીએ.

સુટેવથી સત્સંગનો પાયો નખાય છે અને કુટેવથી કુસંગના માર્ગ ચઢી જવાય છે. ગુરુહરિ સાહેબદાદાએ આપણી બુદ્ધિ, શક્તિ અને

આવડતનો ભક્તિ માટે ઉપયોગ કરીને, ભગવાનના ભાવને પામીને, ભગવાનના સુખે સુખિયા રહેવા સુધીનો ઉપાય બતાવ્યો છે. અને એમાં એમાં એમ બતાવ્યું કે, આપણે જે સત્સંગ કરીએ છીએ, સભામાં આવીએ છીએ, સેવાની પ્રવૃત્તિમાં જોડાઈએ છીએ—એ આપણા પોતાના જીવનઘડતર માટે અને આપણે સુખી થઈએ એ માટે થાય છે; એ એમનો પહેલો પોઝિટિવ ઓપ્રોચ છે. આપણે મંહિરે આવીએ, સભામાં આવીએ, સમૈયામાં આવીએ, શિબિરોમાં જોડાઈએ—એ આપણો કોઈની ઉપર ઉપકાર કરતા નથી. આપણો એટિટ્યુડ એવો હોય કે આપણે જઈશું તો આપણને કંઈક શિખવા મળશે, જાણવા મળશે, તો એ આપણી પોતાની ગરજ છે. પૂ. પણ્ણાજીએ એમની કથાવાતમાં એક બહુ સુંદર સૂત્ર આપ્યું છે કે, ‘પોતાની ગરજે અને ભગવાનની શરતે સેવા કરવા માટે તૈયાર રહેવું.’

સાધુ આપણા માવતર છે. અત્યારના સમયમાં મમ્મી કે પણ્ણા પોતાના સંતાનને એના હિતની વાત વઢી-ધખીને કે દુઃખ વિગાડીને કહી શકતાં નથી. દીકરી હોય તો પગ પછાડે ને દીકરો હોય તો બારણું પછાડે ને ઘરની બદાર નીકળી જાય ને ક્યારે પાછાં આવશે તે નક્કી નથી. આવા સમયમાં આપણું યુવાધન ખરેખર ધન બની રહે એની ફિકર, ચિંતા ને કાળજી ગુરુહરિ સાહેબદાની આજ્ઞાથી અને એમની પ્રસન્નતા મેળવવા માટે આ સંતો કરે છે. તેઓ મા બને છે, બાપ બને છે ને મિત્ર પણ બને છે. ગુરુહરિ સાહેબદાએ અમદાવાદના યુવાનોનો તરવરાટ, સત્સંગ માટેની ધગશ, સમજણ, સેવા અને સમર્પણાભાવ; એને તપોભૂમિ બ્રતિજ્યોતિ આવીને ખૂબ બિરદાવી છે, ખૂબ વખાણ કર્યા છે, ખૂબ રજીપો ને પ્રસન્નતા વરસાવી છે.

પુવાનોએ કે કોઈ પણ વ્યક્તિએ જ્યાં પોતાનું શરીર હોય ત્યાં પોતાનું મન રાખવું એ સૌથી પહેલાંમાં પહેલી ટ્રેઇનિંગ છે, કેળવણી છે. આપણે શરીરથી ક્યાંક હોઈએ છીએ અને મનથી બીજે ક્યાંક ફરતા હોઈએ છીએ. તો એ વાતની ગંભીરતા જ્યાં સુધી આપણે સમજાએ નહીં ત્યાં સુધી ન તો આપણે એકાગ્રતાથી ધૂન-ભજન કે માળા કરી શકીએ, કે ન તો આપણે એકાગ્રતાથી અભ્યાસ પણ કરી શકીએ. વિદ્યાર્થીઓ માટે એકાગ્રતા અને નિયમિતતા બહુ જ અગત્યની ને આવશ્યક બાબત છે જે મોટી ઉંમરે બહુ સારાં અને રૂડાં પરિણામો આપણાને આપે છે અને આપણાને બહુ જ ફાયદાકરક સાબિત થાય છે.

પરિવારથી શરૂ કરીએ તો આપણા ઘરમાં આપણાથી ઉંમરમાં જે ઓ મોટા હોય, સાથે સાથે અનુભવે પણ મોટા હોય, તેઓ કંઈક વાત થાય તો એમ કહે કે, ‘તારા કરતાં અમે વધારે દિવાળી જોઈ છે.’ એટલે કે, જીવનઘડતરની થપાટો ખાઈને એમનું જીવન ઘડાયું છે; એને પરિણામે તેઓ ઊછરતી કિશોર અને યુવાન પેઢીને એમના હિત માટેની કંઈક વાત કરે છે. એટલે પોતાના પરિવાર-કુટુંબથી શરૂ કરીએ તો સાહેબદાદા દરેક શિબિરમાં અત્યંત આગ્રહપૂર્વક એમ કહે છે કે, ‘સવારે વહેલા ઊઠી, નાહી-ધોઈ, પૂજા કરી, માતા-પિતાને ચરણસ્પર્શ કરીને પ્રાણામ કરવા. શ્રી ઇકોરજીનાં દર્શન કરીને પછી સ્ફુરે જાવું.’ સવારમાં આટલી આજીનું જે ઉદ્યમ દિવસ પાલન કરે એના માટે પાછળની બધી આજીઓ સહેલી થઈ પડે છે. સવારમાં વહેલા ઊઠવું. સવારે પોતાનું જે ટાઈમેન્ટેબલ શરૂ થતું હોય એને પહોંચી વળવા માટે થોડા વહેલા તૈયાર થવું. અને ૨૧ દિવસ સુધી તમે પ્રયોગ કરજો. જો ૨૧ દિવસ સુધી પરાણે પણ વહેલા ઊઠી જવાની ટેવ પાડશો તો ૨૨મા દિવસે વગર એલાર્મ કે કોઈના ઊઠાડ્યા વગર તમારું બોડી ક્લોક એવું રિધિમિક બની ગયું હશે કે તમારી આંખો ઊઘડી જશે. સમય બહુ કીમતી બાબત છે, જે વર્થ ગયો ને વેડફાઈઝર્યો એ પાછો નથી મળવાનો. આપણે જે મધિયાળના કાંટાને પાછો ફેરવી શકતા નથી, એમ જીવનચક્ષને પણ આપણે પાછું ફેરવી શકતા નથી. એ આગળ ને આગળ વધતું જાય છે અને આદ્યાત્મિક રીતે શ્રી સ્વામિનારાયણ ભગવાને આપણાને સૌનેય પ્રગતિ કરતાં ચૈતન્યો તરીકે રજિસ્ટર કર્યા છે, એટલે પાછા ફરવાનો તો કોઈ કમ જ નથી.

આપણા દેશમાં એક બહુ મોટા દાર્શનિક સંત આચાર્ય શ્રી રજનીશજી થઈ ગયા. એમણે એમના એક પ્રવચનમાં એમ કહ્યું કે, ‘કોઈ પણ વ્યક્તિ એક નદીમાં બે વખત સ્નાન કર્યું છે. પછી તેઓ બહુ રહસ્યની બાબત સમજાવે છે કે, નદી એટલે વહેલું પાણી, જે દુંગરમાંથી નીકળ્યું

અને જેનું અંતિમ લક્ષ્ય છે દરિયામાં સમાઈ જવાનું. વહેલું જળ એ નહીં છે. અને વૃદ્ધોની માન્યતા પ્રમાણે વહેલું જળ હું મેશાં પવિત્ર કહેવાય. ૨૮નીશજી બહુ તાર્કિક હતા. એમણે એમ કહ્યું કે, એક જ નદીમાં બે વખત સ્નાન કરી શકાય નહીં. કારણ કે તમે સ્નાન કરીને નીકળ્યા ને ફરી એમ થાય કે રેતીવાળા થયા તે પગ ધોઈ આવું તો ફરી પાછા તમે નદીમાં જાવ છો તો તમે જે સ્નાન કર્યું હતું એ જળ તો સમુદ્ર તરફ વહી ગયું, અત્યારે તમે ફરી પગ ધોવા કે ફરી સ્નાન કરવા માટે જાવ ત્યારે તે નવું જળ છે, જે ઉપરથી વહેલું વહેલું આવ્યું છે. એ જ વાત શરીર વિકાસની ભાષામાં જોઈએ તો બાળકમાંથી ડિશોર બને છે. ડિશોરમાંથી યુવાન બને છે. યુવાનમાંથી પ્રોફ બને છે. પ્રોફમાંથી વૃદ્ધ બને છે અને શેખ શરીરના સ્નાયુઓનો પણ વિકાસ થતો જાય છે. એમ આપણા શરીરનું બંધારણ બંધાય એની ઉપર નાનપણથી બહુ જ મોટો આધાર છે. બાળકો દૂબળાં, ખેંખલી, પાતળાં હોય જેને કુપોષણ કહેવાય. આપણી કુટુંબ વ્યવસ્થામાંથી પૌષ્ટિક આદાર ઓછો થતો જાય છે અને પેલાં પડીકાં ને મેગીના દવાદ વધતા જાય છે. ઊછરતી પેઢી સક્ષમ બને એના માટે સરકાર પ્રયત્ન કરી રહી છે, પણ સાથે સાથે સમજદાર માતા-પિતાએ પણ એના માટે સજાગ પ્રયત્ન કરવાની જરૂર છે.

બાળકોને અમુક જ પ્રકારનું ખાવાનું ભાવે છે એટલે એને લાડ કરવા માટે મમ્મી પણ એની ઈચ્છા પૂરી કરે છે. અને નાનપણથી પહેલી એ કુટેવ જે મ ઉંમર મોટી થાય એમ એ કુટેવ પણ મોટી થતી જાય છે. અત્યારે તમે એને ઘેર મેગી ખવડાવો છો પછી એ જાતે હોટેલમાં જઈને મેગી ખાવાનો છે. લારી ઉપર ઊભો રહીને જે ના ખાવા જેવું હોય તે ખાઈ આવે છે, એના ચટાકા કરી આવે છે. એ કુટેવ મોટી થઈ. બાળકો માટે એવું કહેવાય છે કે તેઓ સાંભળો છે ઓછું અને જુએ છે વધારે. કુટુંબ જીવનમાં મારાથી મોટી ઉંમરના કુટુંબના સભ્યો કેવી રીતે બોલે છે, ચાલે છે, બેસે છે, ઊંઠે છે, ખાય છે, પીવે છે - એ બાળકો એમની બહુ જ સૂક્ષ્મ બુદ્ધિથી જોતાં હોય છે ને એને પોતાના જીવન આચરણમાં લાવતાં હોય છે. એટલે અહીંયાં જે યંગ પેરેન્ટ્સ તરીકે કેટલાક સદગૃહસ્થો, માતા-પિતાઓ આવ્યાં છે, એમને કહેવાનું કે, બાળકને કહેવા કરતાં આપણે ખરે ખરાં પાકાં સત્સંગી બનીએ તો આપણું જોઈને આપણું બાળક ખરે ખરો સત્સંગી બનવાનો છે. સત્સંગ કરાવવાનો નથી, સત્સંગ કરવાનો છે. અને જે ઘરમાં આ પ્રકારે માતા-પિતા કે દાદા-દાઈ સત્સંગ કરતાં હશે એમના ઘરમાં આપોઆપ સત્સંગ થવાનો છે.

અમદાવાદ મંડળનું સદ્ગ્રાહ્ય છે, કે આપણાને ભડુસાહેબ-મધુબાહેન, એન.આર.દાદા-ઈલાબા માવતર તરીકે મખ્યાં. જે મનું

પોતાનું જીવન જ આ પ્રમાણેનું હતું અને એમણે આપણને હેત-પ્રેમ આવ્યાં. આપણને સાધુઓ પણ એવા મજ્યા. સાધુ રજનીભાઈ, ગૌતમભાઈ અને વર્તમાનકાળે સતીશભાઈ, ઉત્પલભાઈ નિયમિત સભા કરવા માટે આવે છે. આપણો વારસો બહુજ ઊંચો છે. જે ઓ પોતે એવું જીવ્યાં છે અને એમના સંબંધમાં ને સંપર્કમાં જે જે સંતાનો આવ્યાં, બાળકો આવ્યાં, યુવાન ગૃહસ્થો આવ્યા એમને પણ એમણે આ જ સંસ્કાર તરફ દોર્યાં છે. એ સંસ્કારને ઊજણા બનાવવા માટે આપણે થોડાક સજાગ થવાની જરૂર છે. નાનાં નાનાં બાળકોથી બાળમંડળની પ્રવૃત્તિ, કિશોરમંડળની પ્રવૃત્તિ, યુવકમંડળની પ્રવૃત્તિ, ગૃહસ્થમંડળની પ્રવૃત્તિ; એ જુદી જુદી ઉમરનાંને જુદું જુદું શિક્ષણ આપવાનીને સૌનેય આગળ વધવાનીને સુખિયા થવાની જાચી દિશા એ જ સત્સંગ છે.

આ વર્ષ આપણે ‘શ્રી ગુરુ આજ્ઞા મહિમા પર્વ’ તરીકે ઊજવી રહ્યા છીએ. આપણી દરેક સભાઓમાં ગુરુઆજ્ઞાની મહત્વાનું અને એનાં પાલન કર્યા એનાથી જીવનમાં પરિવર્તન આવ્યું, એનાં પરિણામો જોઈ, જાણીને સંતોષ અને આનંદ વ્યક્ત કરવાનું આ આખું વર્ષ છે. ગુણાતીતાનંદ સ્વામીએ સરસ વાત કરી છે : ‘સત્સંગ એટલે શું ? મોટા એકાંતિકને બે દાથ જોડવા.’ પહેલામાં પહેલું તો એ મારા કરતાં ઉમરમાં મોટા છે, અનુભવમાં મોટા છે, જ્ઞાન-સમજણમાં મોટા છે ; એવો ભાવ દોયતો એમની સામે દાથ જોડાય. પોતાથી મોટા માન્યા, તો તેઓ જે મ કરતા દશે તેમ દીક જ કરતા દશે. તેઓ મોટા છે અને કહે છે, તો એક વખત એમની વાત આપણે માનીએ ને સ્વીકારીએ.

પરિવારમાં માતા ને પિતાનો રોલ અલગ અલગ છે. પણ એ બંનેની વચ્ચે જે ટલી સુસંવાહિતા દશે તે ટલી અસર બાળકના ઉછેર પર થવાની છે. ઘરે મોડા આવનાર દીકરાકે દીકરીને કારણે મમ્મી ને પણ્યા બંનેને ઉચાટને કારણે ઊંઘ આવતી નથી એટલે એમની રાણ જોઈ રહ્યાં દોય છે. દીકરો કે દીકરી આવે એટલે બેય જણાં ઊઠીને-પણ્યા એમની ફરજ બજાવે, ‘ક્યાં હતો આટલી મોડી રાત સુધી ? રખડ્યા કરે છે, ભાન નથી ?’ બીજુ બાજુ મમ્મી એમ કહે છે કે, ‘દીકરા, તારી ભાવતી વાનગી બનાવી છે, મૂકી રાખી છે. પહેલાં દાથ-મોદું ધોઈ લે, ખાઈ લે પછી સૂઈ જા.’

યોગીબાપા ગોલીટો અને ટીપણું-કું ભારના ઓજારનું દાયંત આપતા. માટલું ઘડવા માટે કું ભાર બે ગોળ બેડમિન્ટનનાં બેટ આવે છે એવાં લાકડાનાં સાધન રાખે. એકને ગોલીટો કહેવાય ને એકને ટીપણું કહેવાય. ચાક ઉપર એ ઘડો તો બનાવે, પણ એ ઘડામાં માટીના જે કણ દોય એ બેની વચ્ચે ઓર સ્પેસ દોય. એને ફીટ કરવા માટે ટીપણું નામનું ટીપવા માટેનું એક બેટ દોય. અને બીજું એક બેટ માટલાની અંદર દાથ

નાખી ટેકો આપે કે જે થી ટીપે ત્યારે ગાબડું ના પડી જાય. નહીંતર પેલી કાચી માટી નટીને નીચે પડી જાય તો ફરી પાછું અને ચાક ઉપર ચઢાવવું પડે. એટલે ઉપરથી ટીપે અને નીચેથી સપોર્ટ આપે એટલે માટીના કણ છે એ એકબીજાની સાથે સખત ચોટી જાય. પછી અને ભડીના તાપમાં પકાવે. જો માટલું બરાબર ટિપાયું દોય તો જ્યારે એમાં પાણી ભરે ત્યારે પાણી થોડું ઝમે અને હંડું પાણી મળે. આવી રીતે એક રોપાને કાળજ રાખીને ઉછેરવામાં આવે, સમયે સમયે પાણી પાવામાં આવે, ખાતર આપવામાં આવે, એને કોઈ ઢોરઢાં ખર ખાય નહીં એટલે એની આજુ બાજુ વાડોલું કરવામાં આવે. પછી તો એટલું મોટું ઘેઘર વૃક્ષ થાય કે ચકલા-ચકલી આવીને એમનો માળો એની અંદર બાંધે. અને મોર ખાય, ચોર ખાય ને એટલાં બધાં ફણ એની ઉપર આવે કે બધા લઈ જાય, ભાગિયા ભાગ લઈ જાય, તો પણ ખેડૂતના ઘરમાં ઢગલો થઈ પડે એવી ખેતી થતી અમે જોઈ છે.

બસ, આ વૃક્ષ ઉછેર, આ રોપાનો ઉછેર અના જેવી જ બાબત પરિવારની અંદર સંતાનના ઉછેરની છે. અત્યારે એડોલેશન પિરિયદ ૧૨-૧૩ વર્ષથી શરૂ થાય, ત્યાં સુધી બાળકોનું યોઝ રીતે જતન કરવું એ માતા-પિતા, દાદા-દાદીની સામૂહિક ફરજ બને છે. આપણે જો સભાનતાથી સભા ભરતાં દીઠિએ તો બધાં જ બાળકો, કિશોરો, યુવાનો, યુવાન ગૃહસ્થો, મા-બાપ સૌ આવતાના વિચારને પામીએ કે, આજથી આપણે વધારે નહીં, પણ એક કુટેવને સુટેવમાં પરિવર્તિત કરવાનો જગત પ્રયત્ન કરીશું. કુટેવને સુટેવમાં પરિવર્તિત કરવા માટે જ સત્સંગ છે. એ કરશો તો સત્સંગ બરાબર જ છે ને સાહેબદાદા એનાથી અત્યંત પ્રસત્ત થવાના છે.

આજે આ સભામાંથી આપણે વિસર્જિત થઈએ એ પહેલાં ‘વિવેક’ નું વચ્ચનામૃત છે કે જે દોષ પોતામાં દોય તેને જાણો અને તેને ટાળવાનો પ્રયત્ન કરે. અને ભગવાનના ભક્તમાં કંઈ દોષ જેવું દેખતું દોય તો એને બાજુ પર ઠેલીને એનો જે ગુણ દોય તેને ગ્રહણ કરે. જે સાહેબદાદાએ આપણાને સુહૃદભાવની વ્યાખ્યામાં શિખવાયું કે, ‘૮૮ અવગુણ પાણાઠેલીને એ વ્યક્તિમાં રહેલા એક ગુણ ઉપર આપણે કોકસ કરવું.’ કારણકે, આપણે આપણા સદ્ગુણોનો વિકાસ કરવો છે.

સોનાબા કહેતાં કે, બેંસનાં શિંગડાં બેંસને ભારે અને દોહવા જાય તો એના ઘણીને ભારે. આપણે દોહવા જવાનું નથી. આપણી બેંસનથી. પછી એને મોટાં શિંગડાં છે એની પંચાતમાં આપણે શું કરવા સમય બરબાદ કરીએ ? આપણે ક્યાં કેટલો કેવી રીતે સમય વેડફી કાઢીએ છીએ. અને માત્ર મોડા સૂઈ રહેવામાં જ સમય વેડફાય છે એવું નથી,

જાયા પણ કેટલો સમય વેદજાય છે એ સત્સંગ શિખવાડે જ છે, પણ પહેલાં જાગીએ તો ખરા ! એટલે સ્વામી વિવેકાનંદે પહેલી શરૂઆત કરીકે, ‘હે યુવાનો, ઊઠો, જાગો !’ એટલે શું બધા સભામાં સૂતા હતા ? ના, બધાય સાંભળતા હતા, બધાય જાગતા હતા; પણ એ બધા શરીરથી બેઠા હતા, એમનું મન વાત સાથે પરોવાયેલું નહોતું. અને જે વાત કહેવાય છે તે મને લાગુ પડે ત્યાં ચુંદી એ પહોંચતું નહોતું, એટલે સૂતેલા જ છીએ. જે ના માટે આપણા ઘર્મગ્રંથો એ એમ કહ્યું છે, કે જે ને આ વાતની સૂજ નથી પડતી એ સૂતેલો જ છે. સંસ્કૃતના એક બહુસુંદર શ્લોકમાં કહ્યું છે : ‘જગતને વિશે જે જગેલો છે એ સૂતેલો છે, અને ભગવાનને વિશે જે જગેલો છે એ ખરે ખર ઊઠેલો છે.’

એટલે વિદ્યાર્થીઓ માટે, ડિશોરો માટે, યુવાનો માટે બહુ જ અગત્યની બાબત કે, આપણે અને અહીંયાં બેઠેલાં માતા-પિતા, યુવાન વ્યવસાયી ગૃહસ્થીઓ માટે પણ એક હુમન સાયકોલોજીની ભાષામાં કહીએ તો - આપણે આપણા વ્યક્તિત્વને અનેક ટુકડાઓમાં વહેંચી કાઢવું નહીં. જે કંઈકરવું એ સમગ્રતાથી કરવું. મંહિરે આવવું, ભગવાનના દર્શન કરવાં તો સમગ્રતાથી કરવાં. પણ આપણે આપણા વ્યક્તિત્વને અનેક ટુકડાઓમાં વહેંચી કાઢવું છે એટલે શરીરથી આપણે ભગવાનની સામે ઊભા છીએ, બેઠા છીએ, પણ બીજા અનેક ટેકાણો આપણે વહેંચાયેલા હોઈએ છીએ. એટલે સમગ્રતાથી જે નથી થતું એ સંપૂર્ણ પણ નથી થતું. એટલે ‘નહીં ધરનો ને નહીં ધારનો, નહીં અહીંનો ને નહીં તહીંનો’ એવો ધાર થાય. આવવા ખાતર આવ્યા કરે, ને જવા ખાતર થાય. ‘મન હવાદે માળા ફેરવે, ને ગળા હવાદે ગાય, કોઈ કોઈને પૂછે નહીં, કલ્યાણ કેમ થાય ?’ એટલે નાનપણાથી સમગ્રતાની ટેવ પાડીએ કે જ્યાં શરીર છે ત્યાં જ મન છે, અને ત્યાં જ મારું ભાવજગત પણ છે.

આજે એક રૂડો સંકલ્પ આપણે કરીએ કે, આજથી પહેલામાં પહેલી મને મારી કુટેવ ખબર પડે. અથવા મારા ધરના વડીલો કે સંતો મને ટકોર કરીને મારી કુટેવ વિશે સભાન કરે, જગત કરે તો એમાં બદલાવ લાવવાનો હું સધન પ્રયત્ન કરું, સતત પ્રયત્ન કરું, એની ચાડ રાખું. આધ્યાત્મિક રીતે શ્રી સ્વામિનારાયણ ભગવાને એક શબ્દપ્રોગ કર્યો છે, ‘કૃપાળમાં બળબળતો ડામ હે અને જેવી બળતરા થાય...’ એક ભગવાન સિવાય બીજો કોઈ પણ ધાર થાય, ઈચ્છા થાય, માગણી થાય, તો એ જો ભગવાનનો ખરેખર પ્રામાણિક ભક્ત હોય તો એને બળબળતો ડામ દીધો હોય એટલું દુઃખથાયકે, અરર ! હું ભગવાનનો ભગત છું અને મને આવો વિચાર આવ્યો ? આપણે વાત તો કરીએ છીએ કે, મારા ગુરુ રાજ થાય, મારા પ્રલુબ રાજ થાય, તેવા મારા વિચાર બને, તેવું મારું વર્તન બને, તેવી

મારી વાણી બને, પણ જો એવું ના જિવાય તો એ બળબળતો ડામ લાય્યો કહેવાય. સત્સંગી થઈને મને આ ના શોભે, મને આ ના રૂચે, મારું આ કામ નથી, આ મારી ખાનદાની નથી, આ મારા સંસ્કાર નથી, મારાં માતા-પિતા - મારા વડીલોના સંસ્કાર લાજે. એમ, કશું પણ અધિત કરવાની ઈચ્છા થાય કે થઈ જાય તો આમ કરીને પાણ વળી શકે. આપણે લોકલાજે પણ કેટલીક વખત મર્યાદામાં રહીએ છીએ, કરણ કે લોકોમાં હવે સારા થવાને બદલે સારા દેખાવાના પ્રયત્ન કરવામાં આખી જિંદગી પૂરી થઈ જાય છે.

આપણે જો પ્રામાણિક હોઈએ, ભક્ત હોઈએ તો આપણે સારા થવાનો પ્રયત્ન કરવાનો છે, સારા દેખાવા માટેનો નહીં. અનેજો સારા થયા હશો તો સારા જ દેખાવાના છો. સારા એટલે રૂપાણા નહીં - સારા એટલે સંસ્કારવાળા. અમે સાધુ તરીકી જો અમારી સાધુની મર્યાદામાં ના જીવીએ તો સમાજ અમને પણ એમ કહે કે, ‘સાધુ છો કે કોણ છો ?’ તો મને પણ એવી અવેરનેસ રહેવી જોઈએ કે હું સાધુ છું. એમ, દરેક વ્યક્તિને પોતાનું કુટુંબ-પરિવાર, પોતાનું જે સ્ટેટ્સ - વિદ્યાર્થી હોય તો વિદ્યાર્થી, વ્યવસાયી હોય તો વ્યવસાયી, પરિવારના વડીલ હોય તો વડીલ તરીકિના મોભાની મર્યાદામાં ને એને ઊજળો બનાવે એવો રોલ ભજવવાનો છે. આજરે તો આ જીવનના તખ્તા ઉપર, આ સ્ટેજ ઉપર, આપણે બધા એકટરો જ છીએ. જેને જે પ્રકારની સેવા જે ના હિસ્સે આવે એ સંપૂર્ણ વફારારી અને પ્રામાણિકતાથી જેટલી બજાવે એટલો એને એનો રોલ સફળ ભજવ્યો એમ કહેવાય. આપણે સત્સંગ અને સત્સંગના નામે જ્યારે આટલું બધું કરતા હોઈએ ત્યારે આપણે ખરેખર સાચા પ્રામાણિક અને સિન્સિસ્પર પ્રયત્ન કરનારા સત્સંગી બની રહેવું જોઈએ. આપણે તો બધા યુવાન છીએ, દાંશીલા છીએ, ભણેલા-ગણેલા, ધગશ, ઉમંગ અને સાથે સાથે જીવનમાં કાંઈક કરવું છે, કંઈક મેળવવું છે, આગળ વધવું છે તેવી મહિત્વાકાંક્ષા છે. પણ જીવન ઘડતરના પાઠ જીવન જીવતાં જીવતાં શિખાય છે. એમ કહેવાય છે કે, જે બુદ્ધિશાળી-અક્કલવાળો માણસ છે એ એના જીવનમાં ક્યારેક જ ભૂલ કરે છે. પણ ‘મનુષ્ય માત્ર ભૂલને પાત્ર’-ભૂલ તો કરે જ. પણ ભૂલમાંથી જે પદાર્થપાઠ શીખે છે અને ભૂલને સુધારે છે એ ખરેખરો અક્કલવાળો છે. હવે ભગવાને આપણાને એટલી તો અક્કલ દીધી નથી કે આપણે ભૂલ જ ના કરીએ. તો આપણી પાસે બીજી ચોઈસ છે, કે આપણા દ્વારા થયેલી ભૂલને સુધારીને આપણે એને જીવનઘડતરનો પાયો બનાવી દઈએ અને પોતાનો વિકાસ આગળ ચલાવીએ. એટલે ફરી પાછું ત્રીજી વખત કરું છું કે, અહીંથી ઊઠીએ ત્યારે નક્કી કરીને ઊઠીએ કે, મારા જીવની જે કોઈ કુટેવ હોય તેને સુટેવમાં રૂપાંતરિત કરવાનું કામ હું આવતી કાલ સવારથી જ શરૂ કરી દઈશ.

સહજાનંદ સ્વામી મહારાજની જય !

# A Journey Through Guru Aagnas

~ Saheli Sheth (Peoria, USA)

I postponed writing this article for a while. Sadguru Sant PP Manojdasji had suggested writing on the topic of "the impact of *guru aagna* in my life," but there are not enough words in any dictionary in this universe to fully grasp the glory of *guru aagna*.

Reflecting upon my journey with *aagnas*, I realize that through them, my gurus have been showering me with a hidden blessing: healthy habits.

The first *aagna* from Sadguru Sant PP Shantidada: no fried food for a year. This taught me the importance of treating my body, the vessel for my soul, as a temple. Four other *satsangis* from Peoria Mandal voluntarily took the same *aagna* themselves when my sister and I did, teaching me the power of community.

My second *aagna*: a maximum of 1 hour of TV per day for a year. Over time, this integrated positive values into our family as we spent less time watching TV and more time connecting.

Next: Shantidada guided me to stay in touch with certain *satsangis*, teaching me that friendship is a stepping stone to my well-being.

Then: Write 15 minutes of *Bhagwan ni vaato* per day. Thus, I cultivated my habit of journaling and writing daily letters to God. Because Shantidada specified writing "*Bhagwan ni vaato*," and Bhagwan lovingly guides us to train our minds to see the positive, these became letters of gratitude to God.

After that *aagna*, Sant Bhagwant Sahebji encouraged me to take dance classes. Dance became a healthy habit that I relied upon as a firm foundation to deal with stress.

At this point, my support system was strong. I had a powerful toolkit of coping skills to deal with the stress of life: community, family connection, friendship, positive thinking, journaling, and dance.

And then Shantidada threw a curveball. He guided me to accept a full-time position as a trauma therapist for kids and teenagers. Of course, he had been preparing me for this divine assignment for years - all of his *aagnas* had

given me a firm foundation of ways to take care of myself. Tears stream down my face now as I imagine how he handwrote my life with so much care, how he poured so much thoughtfulness and intention into the life of every devotee.

Though Shantidada and Sahebdada had given me all these ways to relieve stress, it still felt like the stress of the job outweighed the resources that I had. But while we may encounter struggles, our gurus never, ever, ever abandon us. Manojdasji supported me with additional *aagnas*: He guided me to write monthly Brahmanirzar articles and suggested that I ask God to work through me daily. Through this, he taught me to continue writing and daily conversation with God as stress relief skills.

Now, as Manojdasji has led me to my next therapist role, I feel prepared because of a general *aagna* that we all are given: 30 minutes of *dhun*. I find that the best way to hold myself accountable for doing *dhun* is pairing it with walking outside for 30 minutes. This week, I reflect upon my state of bliss as I walked outside in the brisk mornings or sunset evenings, chanting God's name and thanking Him for His mesmerizing creation: the golden sun caressing my face, the geese freely gliding through the air, the nearby pond's water dancing and swaying with ripples, the sweet smell of flowers as I walk past homes, the dew shimmering on the grass after a night of rain, and the fresh scent of spring and new beginnings. In this simple *aagna* of doing *dhun*, an entirely new skill was unlocked for me: walking and connecting to nature.

This is the power of *aagnas*. It's not that our guru is trying to make life difficult for us. It is exactly the opposite. I think our guru recognizes that life can be inherently difficult and painful, so these *aagnas* unlock the door to living life with peace and sanity. When I look back on my spiritual journey, I see these *aagnas* were the life vests thrown my way to keep me afloat.

If we are brought face-to-face with a challenge, our guru's *aagna* can give us a helping hand through it. ***Aagnas are proof of our guru's love for us.***

# માતા-પિતાનો શુક્ર પ્રેમ : બાળકો માટે એક પવિત્ર નજરાણું

~ ભાવાનુવાદ સંકલન : સંગીતાબેન મોડી (અમદાવાદ)

મને રસોઈ બનાવતાં નથી આવડતું તેમ માનીને એક વડીલે મને મજાકમાં ‘ડોબી’ કહીને બોલાવી. મારું મગજ તરત જ તારણ કાઢવામાં લાગી ગયું કે, તેઓનો સ્વર મજાકનો હતો કે પૂર્વગ્રહયુક્ત હતો. મને તે પૂર્વગ્રહયુક્ત લાગતો હતો.

પછી તો, તે ક્ષાણો જ મારા દિલમાં એક ભાવુક પ્રતિક્ષિયા રૂપે પીડાએ જન્મ લીધો. આમ તો આવા પ્રસંગે નિર્દોષબુદ્ધિ રાખવા અને શિખવવામાં આવેલા અન્ય આધ્યાત્મિક બોધપાઠ મારા મનમાં યાદ આવવા જોઈતા હતા. પરંતુ, મને તે કંઈ પણ યાદ આવે તે પહેલાં જ મારા મને તે પીડા પ્રત્યે કેવી રીતે સાહિત્યક પ્રતિક્ષિયા આપી દીધી તે જોઈને મને આશ્રમ થયું.

મારું મન મને કહી રહ્યું હતું કે, ‘તે વડીલે જે કહ્યું તે તારા માટે ઉચિત નહોંતું. તારા ગુરુએ કે તારાં માતા-પિતાએ પણ તને ક્યારેય આવા અસર્ય શબ્દથી બોલાવી નથી. વળી, તતે જે કહેવામાં આવ્યું, તે પ્રેમથી પણ નથી કહેવાયું, તો તે તારા માટે તો નહિ જ કહેવાયું દીય.’

પણ હું જરાય વિચલિત થયા વગર સસ્થિત ત્યાંથી ચાલી નીકળી. મારા માટે આવું કેવી રીતે શક્ય બન્યું ? વર્ષોથી મારાં માતા-પિતા મારી પર એટલો બધો પ્રેમ વરસાવી રહ્યા છે કે જ્યારે કંઈ પણ અપ્રિય સાંભળવામાં આવે ત્યારે તે મને અધોઝ જ લાગે છે. જો કોઈ બાબત આદરપૂર્વક પ્રસ્તુત ના થાય તો તેને જતી કરવી તે મારા માટે સહજ છે. જો તમે તમારાં બાળકોને ભરપૂર પ્રેમ ને આદર આપ્યા હોય તો તેઓ પોતાના માટે જે કંઈ પણ યોઝ નહિ હોય તેનો સાહિત્યક રીતે અસ્વીકાર કરી શક્શે.

સંતભગવંત સાહેબદાદાએ પણ કહ્યું છે કે, જો કોઈ આપણને ગંધેડો કહે એટલે શું આપણો તેવા થઈ જઈશું ? એનો અર્થ કે શું હવે આપણા કાન મોટા થઈ જશે અને પૂછું છી તુ઱ી નીકળશે ? જો આપણો તેની સામે કોઈ પ્રતિક્ષિયા આપીએ કે વિચલિત થઈએ તો એનો અર્થ એવો થાય કે, તેમણે આપણને જે શબ્દો કહ્યા તેનો આપણો સ્વીકાર કર્યો છે.

મારાં માતા-પિતાએ મને પ્રેમ શું છે ? તેનું સાચું દર્શન કરાવ્યું છે તેથી હવે જ્યાં પ્રેમ નથી હોતો તેને હું સારી રીતે સમજી શકું છું. જ્યારે કોઈ મારી સાથે ઊંચા સાંદે વાત કરે છે અથવા મારી સાથે આદરપૂર્વક વર્તણૂક નથી કરતા ત્યારે મારા મનમાં એલાર્મની ઘંટી વાગી ઉઠે છે. હું જાણું છું કે, જે ઓએ મારો ઉછેર કર્યો છે ને મારો ખરાબ સમય પણ જોયો છે અને ત્યારે પણ તેઓએ મને પ્રેમ જ આપ્યો છે; તો તેથી કંઈ પણ ઓછું સ્વીકારં તે મારામાં રહેલા ભગવાનને પણ નહિ ગમે.

આ જ રીતે, ભગવાને અને ગુરુએ ઉચ્ચ કષ્ટાના પ્રેમ માટેનો આદર્શ સ્થાપ્યો છે. કેટલાંક વર્ષો પહેલાં, મારી ડિશોરાવસ્થામાં મને અને મારાં કેટલાક સત્યંગી ભિત્રોને સદગુરુ સંત પૂ. શાંતિદાદાને બીજા શહેરમાં લઈ જવાની

સેવા સૌંપવામાં આવી. તે રાત્રે કલાકેકની મુસાફરી દરમિયાન આણ પ્રકાશવાળા રસ્તાઓ સમારકામના કારણે બંધ થઈ ગયા હતા, તેથી અમારે બીજા રસ્તા તરફ ફંટાવું પડ્યું અને એમાં અમે ભૂલાં પડી ગયાં. કલ્પના કરો કે, એક સદગુરુ સંત અને તેઓની સાથે હાલમાં જ નવું દ્રાઈવિંગ લાયસન્સ મળ્યું છે તેવી ત્રણ ડિશોરીઓ. કોઈ પણ સમજી શકે કે, ઘરના લોકો ચિંતા અને ગભરાટમાં કેવા આતુરતાપૂર્વક રાખ જોઈ રહ્યા હશે અને કદાચ તેમના પ્રિય શાંતિદાદાને અમારી સાથે મોકલવા બદલકેવો અફસોસ કરી રહ્યા હશે.

આખરે જ્યારે અમે અમારા મુસાફરી પહોંચ્યાં ત્યારે શાંતિદાદા અમારા બચાવમાં આવ્યા. તેઓએ મુસાફરી દરમિયાન રસ્તાના કુદરતી સૌંદર્યનું વર્ણન કર્યું અને અમારી સાથે વધુ સમય વિતાવવા મળ્યો તેની ખુશી વ્યક્ત કરી. અમારી આવી ભૂલથી કેટલાક શાણા વડીલો બેચેન થયા હશે, પણ પણ શાંતિદાદાએ તો અમારી સાથે હરહંમેશની જે મજ પ્રેમપૂર્વક વ્યવહાર કર્યો.

તેઓએ આવો વ્યવહાર કરવાની કંઈ જરૂર નહોતી. ભૂલા પડવા બદલ તેઓ અમને દોષ દઈ શક્યા હોત અને અમે બિનજવાબદાર ડિશોરીઓ છી એ તેવું પણ તેઓ માની શક્યા હોત. પરંતુ, તેના બદલે શાંતિદાદાએ તો પોતાના સાહિત્યક સ્વભાવ મુજબ અમને સૌને હિંદ્ય અને નિર્દોષ જ માન્યાં. તે સમયે પણ ભગવાન અમારાં દ્વારા દર્શક કરી રહ્યા છે તેવા ભાવ અને જગતતા સાથે તેઓએ અમારી પર અપાર પ્રેમ વરસાવ્યો.

બીજાઓને તુંકારે અથવા મોટા અવાજે બોલાવવા તે કંઈ પ્રેમ નથી. ભૂલો બદલ તેઓની આલોચના કરવી તે પણ પ્રેમ નથી. બીજા સાથે તેઓની સરખામણી કરવાની નથી કે તેઓ કંઈ અભગ હોય તેવી આશા રાખવાની નથી. હું આ જાણું છું કારણેકે, મારા ગુરુએ મને ખૂબ પ્રેમ આપ્યો છે.

મારા ગુરુનો પ્રેમ કેવો છે ? તેમને મન તો સર્વમાં રહેલા ગુણોનાં દર્શન કરવાં એ પ્રેમ છે. આત્માને શાંતિ પમાડે તેવી મધુર વાણીનો ઉપયોગ કરવો તે પ્રેમ છે. કોઈની ભૂલ થાય ત્યારે સહન કરવું અને ક્ષમા આપવી તે પ્રેમ છે. તેઓ જે વાંછે તેવા તેમનો સ્વીકાર કરવો તે પ્રેમ છે.

આપણા ગુરુએ આપણા માટે જે આદર્શ પૂરો પાડ્યો છે તેનું આપણે અનુસરણ કરીએ. તેઓએ આપણને શુદ્ધ અને અપાર પ્રેમ આપવાની રીત શિખવાની છે. પ્રેમ શું છે તેની આપણી પાસે સચોટ ઢપરેખા હોવાથી પ્રેમ શું નથી તે આપણે ઓળખી શકીશું.

ચાલો, આપણે આપણાં બાળકો અને સ્નેહીજનોને આ જ પવિત્ર ભેટ આપીએ: જ્યારે આપણે તેમને પ્રેમકેવો હોય તેનો અનુભવ ઘરમાં કરાવીશું, ત્યારે તેઓ માટે ઘરની બદલ કુસંગથી બચવા માટેનું કવચ તીબું થશે. ત્યાર પછી તેઓ માત્ર શુદ્ધ પ્રેમનો જ સ્વીકાર કરશે અને પરિણામે સમગ્ર વિશ્વમાં તેઓ પ્રેમકેવાવશે.

(સહેલી શેઠના ‘બ્રહ્મનિર્જર’-એપ્રિલ, ૨૦૨૪ના અંકમાં પ્રકાશિત મૂળ અંગેજ લેખનો ભાવાનુવાદ)

# ॥ ગુરુની આજ્ઞા : શિષ્યની જીવનદોરી ॥

~ સાધુ હિંમત સ્વામી (અનુપમ મિશન, યુ.કે.)

**ગુરુઆજ્ઞા** મહિમા પર્વ આપણે સૌ ઊજવી રહ્યા છીએ ત્યારે સંતભગવંત સાહેબજીનું ગુરુભક્તિસભર જીવન સતત આપણી નજર સમક્ષ રાખીએ. બ્રહ્મસ્વરૂપ ગુરુદેવ યોગીબાપાના આશીર્વાદ અને તેમની આજ્ઞા પ્રમાણે સમગ્ર જીવન તેઓએ અકલ્પ્ય ગુરુભક્તિમાં જ વિતાવ્યું અને આજે પણ એ પ્રમાણે જીવીને સૌને ગુરુભક્તિ અદા કરવાનું શિક્ષણ આપી રહ્યા છે. ‘યોગી ગીતા’માં યોગીબાપાએ પણ ઉદ્ઘેખ કર્યો જ છે કે, ‘મેં ૪૦ વર્ષ વાસણ ઊટક્યાં છે અને શાશ્વીજી મહારાજની આજ્ઞાનું પાલન કર્યું છે તેથી સુખિયો થઈ ગયો છું.’ યોગીબાપા આવા અદ્ભુત દાસભાવે-સેવકભાવે જીવા, તેથી લોકોને તેમના માટેનાં ગ્રેમ અને લાગણી કાયમ રહ્યાં. તેવી જ દાસત્વભક્તિ સંતભગવંત સાહેબજીએ પણ સદાય રાખી. તેઓ ડાઉન ટુ અર્થ જીવન જીવી રહ્યા છે તો કોઈ પણ ભાઈઓ-બહેનો-વડીલો અને અન્ય હિન્દુ ધર્મના મહાનુભાવો-સંતો સાથે સહજતાથી, સ્વાભાવિકતાથી તેઓ તેમના જેવા થઈ જાય છે. આવી સ્વાભાવિકતાનું દર્શન છેદ્વાં પર વર્ષથી તેઓ કરાવી રહ્યા છે અને તેના પાયામાં તેમણે તેમના ગુરુની દરેક આજ્ઞાનું અનુસંધાન રાખીને અદા કરેલી ગુરુભક્તિ છે.

સંતભગવંત સાહેબજીએ વર્ષોવર્ષ યુ.કે. આવીને જે આજ્ઞાઓ આપી છે તે ઘણી વખત અશક્ય લાગે, પણ દરેક વખતે તેમની સામર્થીનાં દર્શન થયાં છે. યુ.કે.માં ‘અં કિમેટોરિયમ’ બાંધવાની પરવાનગી તેમના જ આશીર્વાદથી મળી તે વાત આપણને સૌને ખબર છે. આમ તો પ્રથમ વખત આપણી રજૂઆત રિઝેક્ટ થઈ અને પછી સંતભગવંત સાહેબજીએ પૂ. સતીશભાઈ અને પૂ. ભાવિશાને તે અંગે અપીલ કરવા આજ્ઞા કરી. પૂ. ભાવિશાને આજ્ઞા કરી કે, ‘આપણી હિન્દુ સંસ્કૃતિમાં ૧૬ સંસ્કારો અને તેમાંય અંત્યેષ્ટિ સંસ્કારવિધિ માટેની યોગ્ય માહિતી એકત્ર કરી પછી અપીલ કરો.’ તેમની આ આજ્ઞાની સાથે તેમની મૂર્તિની અદ્ભુત સામર્થીનાં દર્શન થયાં અને પરવાનગી મળી. સાથે જ વિશેષ પરવાનગી મળી ‘અં કિમેટોરિયમ’ માટે આપણા કેમ્પસની પાછળના ભાગમાં આવેલ રસ્તો વાપરવાની!

તેનો ઈતિહાસ એમ છે કે, અનુપમ મિશનના કેમ્પસની પાછળના ભાગમાં એક રસ્તો છે જે ખાસ વપરાતો નહોતો પણ અનુપમ મિશનને તે વાપરવાનો અધિકાર તો સરકારશીએ આપ્યો હતો જ ! પરંતુ, જ્યારથી ‘અં કિમેટોરિયમ’ બાંધવાની પરવાનગી મળી ત્યારથી તે રસ્તો જેની જમીન પર છે તે બહેન (મિરાંડા)એ આ રસ્તો વાપરવાનો વિરોધ કર્યો. તેમણે તો ત્યાં સુધી કચું હતું કે, ‘હું જીવું છું ત્યાં સુધી આ રસ્તો ‘અં

કિમેટોરિયમ’ માટે વાપરવા નહીં હતું !’ પરંતુ, ત્યારે પણ સંતભગવંત સાહેબજી બોલ્યા હતાકે, ‘મિરાંડા આપણાને રસ્તો આપશે !’ આ તેમનો તેમના પ્રભુ અને ગુરુ પ્રાણેના વિશ્વાસનું પ્રતિબિંબ હતું ! અને બન્યું પણ એવું જ કે, સંતભગવંત સાહેબજીની પ્રાર્થના અને સામર્થીને પરિણામે જ અશક્ય શક્ય બન્યું. પૂ. સતીશભાઈએ પણ આમાં ખૂબ જ દાખલો કર્યો. થોડા જ સમય બાદ મિરાંડાએ તે રસ્તો વાપરવાની પરવાનગી રજીખુશીથી આપી. તે પણ મૌખિક નહીં પરંતુ, કાયદાકીય વેખિત બાંદેધરી સાથે !

આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન સંતો અને સેવકોએ સંતભગવંત સાહેબજીની આજ્ઞા અને કેવળ ભજનનો જ આશરો લીધો તો આજે પાછળનો આખો રસ્તો પણ તૈયાર થઈ રહ્યો છે. વળી, તેઓએ પૂ. સતીશભાઈને સૂચન કર્યું છે કે, આ વર્ષ શ્રી ઠાકેરજી મહારાજની પ્રતિષ્ઠાની દશાબ્દી ઉજવાય ત્યારે ઓગસ્ટમાં આપણે ‘અં કિમેટોરિયમ’નું મકાન બહારથી તૈયાર કરીને સાધુ, સંતો અને અગ્રણીઓ પાસે લોકાર્પણ કરાવીને પછી આગળનું કામકાજ ચાલુ રાખીશું.

તેવી જ રીતે ગુરુવર્ષ સાહેબદાદા સર્વ પ્રથમ વખત ઈંગ્લેન્ડ પદ્ધાર્યા તેને સન ૨૦૨૩માં ૫૦ વર્ષ પૂર્ણ થયાં અને તે જ્યોબલ પિલ્ગ્રિમેજ (pilgrimage)ની સુવાર્ણ જયંતીનો ઉત્સવ ખૂબ જ મોટે પાયે ઉજવવાનો નક્કી થયો. તે નિમિતે મોટા ભાગનાં સંતો-યુવાનો અને સમર્પિત દીકરીઓને ભારત અને અન્ય દેશોથી યુ.કે. બોલાવવાની ઈચ્છા ગુરુવર્ષ સાહેબદાદાએ દર્શાવી આજ્ઞા પણ કરી. લૌકિક દશ્ટિએ જોતાં તે કામ ખૂબ અધરું હતું, પરંતુ તેમની આજ્ઞા અને આશીર્વાદ હતાં તો સાચે જ ખૂબ મોટી સંખ્યામાં સૌને વિજા મળી ગયાં અને સૌ પદારી શક્યાં. તે માટે લોડ પોપટ, લોડ ગઢિયા અને પૂ. સતીશભાઈનો આભાર છે.

આજે આ બધું જ ગુરુદેવની આજ્ઞાપાલનના ફણ સ્વરૂપે જ થતું દેખાય છે. વચ્ચે સંઘર્ષ ખૂબ જ આવે છે, પણ અનુસંધાન ગુરુ તરફ રાખીએ છીએ તો સથયાં સરળતાથી ગોઠવાતું જાય છે. અનુસંધાન કે આપણા મનની વૃત્તિ તેમના તરફથી ભર્યી જાય છે ત્યારે ઘર્ષણો ઊભાં થાય છે. આવા અસંખ્ય પ્રસંગોમાં સાહેબદાદા જે આજ્ઞાઓ કરે છે ત્યારે કેવળ તેમના તરફ દશ્ટિ રાખી, જરાય આંશકા કર્યા વગર મંડી પડીએ છીએ તો તેમની સામર્થીનાં દર્શન થાય છે. તેથી હવે પ્રાર્થના એટલી જ છે કે, હે સાહેબદા ! આપની કોઈ પણ આજ્ઞા જરાય આંશકા કર્યા વગર પળાય અને તે જ કેવળ અમારી જીવનદોરી ઇપ બની રહે તેવી નિષ્ઠા કેળવાય !

# Blessed To Have Sahebdada - Our Spiritual Guru !

~ Dinesh kumar Posaria and Shushma kumari Posaria (From Karachi, Pakistan, recent from Maryland USA)

**Jay** Shri Swaminarayan !

"Little by little, day by day, what is meant for you will find its way" This is what happened to us when we started our journey with the beloved Sahebdada.

In 2004, we moved to Pennsylvania from New Jersey in search of a business and we bought a gas station in Whitehall, PA. As we are from Karachi, Pakistan where there were mandirs but no concept of Satsang, Sabha and Gurus. We met Sahebdada when we came to Allentown, we went to Strawberry Acres for strawberry picking where we saw the mandir on the mountain and we headed towards it. We reached and with a very warmly welcomed by Bakiben (Sangitaben), Sunitaben, Rajabhai, Jayeshbhai, Arvindbhai, Barristerdada and DidiBa. Basically, we are from Karachi, Pakistan. Born and brought up in Karachi.

As a true Hindu, we belong to very religious family in Pakistan. Shushma came on a visit visa from Pakistan after we got married in Karachi and overstayed in the U.S. as in U.S didn't have a valid status. We decided to move to Canada and applied for Canadian business visa, and we moved to Canada in 2006.

We started going to temple and met Sahebdada one day. He was just like a Father to us. After two years when we migrated to Toronto, Canada, we didn't even think of meeting the Anoopam Mission family again. But as we mentioned before, little by little, what is meant for you will find its way. When we were stable, and got our field jobs, bought a house after 6 months in Etobicoke, Toronto and called Jayeshbhai (Allentown). He asked us what the address is and when he heard our address, at once he said, "oh okay let me call you back". After few minutes, we got a call from Jayeshbhai saying "oh its same street where Panna and

Akshay live" - 45 Silverstone Drive was Akshay bhai's address and 90 Silverstone Drive was ours.

Then after we started going to Sabha and became so close to all the Satsangis and again it was like a family to us. As we have 2 car garages and a long driveway in our house, mission team started making food for all the big occasions and celebrations and take it to the mandir where the program was done. Because that time there was no Anoopam mission mandir so far.

One day, Ashwindada came and named our garage "Yogi Prasad". We were so blessed to have this opportunity. We were so glad to obey per Sahebdada's Agna. We lived there for 14 years, we asked Sahebdada "can we move back to US in 2013?" He replied, "you are needed more in here," so we accepted his Agna and stayed in Canada. Till 2019, Sahebdada used to visit us very often one day Sahebdada came to Toronto in our place and said, "now you can start packing to move to US" and we were already waiting for his Agna so decided to move back. Both our children Khushboo and Parth went to Penn State, university in PA and we came to Virginia on a business visa and now we are settled down in Maryland with an ice cream store. Too many struggle and ups and downs we went through as it was covid time slowly and gradually with the grace of God and sahebdada's Dhun Prarthna keeping him first in our life, followed his path with a spiritual growth, living A very happy and blessed life now. Our Maryland mandal is also very lovable and helpful. Sahebdada is a father figure to us, and we are blessed to have him in our lives. We found such a spiritual Guru in our life. We love you SahebDada !

Jay Shri Swaminarayan.



## યોગીજ મહારાજનું જીવન અને કાર્યો

~ યાદ્વ રણમિતા બટકાર્થ (B.A.; SEM-04) યોગીજ મહારાજ મહાવિદ્યાલય, ધારી

બ્રહ્મસ્વરૂપ ગુરુદેવ યોગીજ મહારાજની શતાબ્દી પ્રસંગે સ્થયાયેલા યોગીજ મહારાજ મહાવિદ્યાલય, ધારી દ્વારા પ્રતિ વર્ષ અમેરિકા સ્થિત અક્ષરમુક્તો પૂ. પ્રેરણાભણ અને પૂ. મીનેશભાઈ પટેલના સૌજન્યથી 'યોગીજ મહારાજ જીવનદર્શન' વિષય ઉપર વિદ્યાર્થીનો નિબંધલે ખન કરે છે. આ વર્ષે જે નિબંધને પસંદ કરવામાં આવ્યા છે તેમાંના બે નિબંધોમાંથી દ્વિતીય નિબંધ અને યોગીજ મહારાજના પ્રાગટ્ય મંગળે પ્રકાશિત કરીએ છીએ. - તંત્રી

યોગીજ મહારાજ સ્વામિનારાયણ સંપ્રદાયના સંત અને ભગવાન શ્રી સ્વામિનારાયણના આધ્યાત્મિક અનુગ્રાહી હતા. તેમણે ૧૬ વર્ષની ઉંમરે ગૃહિત્યાગ કરીને સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ તરીકે દીક્ષા લીધી અને 'સાધુ જ્ઞાનજીવનદાસજી' નામ ધારણ કર્યું.

યોગીજ મહારાજનો જન્મ કાઠિયાવાડના અમરેલી જિલ્લાના ધારી નામના નાના શહેરમાં લુણાણા પરિવારમાં સંવત ૧૯૪૮ના વૈશાખ વચ્ચે બારશને દિવસે થથો હતો. તેમના પિતાનું નામ દેવચંદ્રભાઈ તથા માતુશ્રીનું નામ પુરીબાઈ હતું. તેમનું બાળપણનું નામ 'જીણાભાઈ' હતું. માતા-પિતા વ્યાલથી તેમને 'જીણા' કહીને જ બોલાવતા. યોગીજ મહારાજ બાળપણથી ભણવામાં ખૂબ દોષિયાર હતા. દરેક ઘોરણમાં એમનો પહેલો નંબર જ આવે અને ઈનામો પણ ખૂબ મળતાં. વર્ગમાં સૌથી દોષિયાર હતા.

ધારીના મંદિરની સેવા જીણાભાઈના કાકા મોહનભાઈ કરતા. પણ મોહનકાકા હવે વૃદ્ધ થઈ ગયા હતા અને વારંવાર માંદા પડી જતા હતા આથી તેમને ચિંતા હતી કે હવે ઢાકોરજીની સેવા કોણ કરશે? તેવામાં એમની નજર જીણા એટલે કે યોગીજ મહારાજ ઉપર પડી. તેમણે તેમને સેવા કરવા પૂછ્યું. એ સમયે તેઓ ખૂબ રાજી થઈ ગયા અને આનંદમાં આવી ગયા. તેમણે તેમના કાકાને કહ્યું, 'તમે ચિંતા ના કરશો. હું ઢાકોરજીની સેવા કરીશ.' એ દિવસથી તેઓ શ્રી ઢાકોરજીની સેવા કરવા લાગ્યા. ઢાકોરજીને નવડાવે, ચંદન અર્યો, કુમકુમનો ચાંદલો કરે, અગરભરીનો ધૂપ કરે, શ્રી ઢાકોરજી પાસે દીપ પ્રગટાવે, આરતી કરે અને આમ તેઓ શ્રદ્ધાથી પૂજા કરતા. તેઓ સવાર-સાંજ મંદિરમાં જ રહેતા અને ઢાકોરજીની સેવા કરતા તથા સંતો પદ્ધારે ત્યારે ભક્તિભાવથી તેમની સેવા કરતા. તેમની સેવા જોઈને બધા એમની પર રાજી થઈ જતા અને તેમને આશીર્વાદ આપતા.

સદ્ગુરુ કૃષણચરણદાસ સ્વામી અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીના કૃપાપત્ર શિષ્ય-માધવચરણદાસ સ્વામીના શિષ્ય હતા. તેમણે એમની ભક્તિ જોઈ. થકી જાય તો પણ એ સેવા કરે એ જોયું. તેઓ તો તેમની સેવા અને ભક્તિ જોઈ ખૂબ પ્રસત્ર થઈ ગયા અને એક દિવસ તેમણે જીણાભાઈને

પૂછ્યું, 'જીણા, સાધુ થઈશ?' તેમણે નિર્દોષતાથી જવાબ આપ્યો 'હા સ્વામી! સાધુ બનાવો તો સારુ. મારી એ જ ઈચ્છા છે.'

સંવત ૧૯૬૫ના કારતક સુદ સાતમે તેમની ૧૬ વર્ષની ઉંમરે તેમણે ઘરનો ત્યાગ કર્યો અને મોટા ભાઈ સાથે જૂનાગઢ જવા નીકળ્યા. જૂનાગઢમાં સદ્ગુરુ કૃષણચરણદાસ સ્વામીને મળ્યા. ૧૪ મેના દિવસે સ્વામીએ તેમને સ્વામિનારાયણના સાધુ તરીકે પાર્ષ્વી દીક્ષા આપી અને પછી તેઓ 'જીણાભગત' બન્યા. તેઓ એમના મંડળ સાથે સ્વામિનારાયણ ભગવાનની સેવા કરવા લાગ્યા.

યોગીજ મહારાજ તદ્દન નિઃસ્પૂદી હતા. નાના સાધુ હતા છતાં પણ કાંઈ ઈચ્છા નહોતી. આખો દિવસ કથા, કીર્તન, મુખપાઠ અને સેવામાં જ મન્ન. તેમના મુખ્ય ગુરુ શાસ્ત્રીજ મહારાજ હતા. યોગીજ મહારાજ ઉંમરમાં નાના છતાં સેવામાં મહાન હતા.

સંવત ૧૯૬૭ના ચૈત્ર સુદ તેરસને દિવસે સવારે આચાર્યશ્રી શ્રીપતિપ્રસાદજ મહારાજે જીણાભગતને વડતાલમાં ખૂબ જ ધામધૂમથી ત્યાગીની દીક્ષા આપી અને 'સાધુ જ્ઞાનજીવનદાસજી' નામ પાડ્યું હતું. જૂનાગઢના સંતો-દરિબક્તો તેમને 'યોગી' કહીને જ બોલાવતા અને સદ્ગુરુ કૃષણચરણદાસ સ્વામીને 'જ્ઞાનજી સ્વામી' કહીને બોલાવતા.

શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના આધ્યાત્મિક વિકાસ માટે યોગીજ મહારાજે ધાણું કાર્ય કર્યું. રાત-દિવસ જોયા વગર ગામડે-ગામડે વિચરણ કર્યું-'દીવો ત્યાં દાતણ નહીં અને દાતણ ત્યાં દીવો નહીં.' જ્યાં જાય ત્યાં યોગીજ મહારાજનું સન્માન થતું. વર્તમાન ધરાવવા મુમુક્ષુઓની ભૂદ થતી. ઉત્સવો અને સમૈયાઓની પરંપરા ચાલતી. સત્સંગ સમુદ્દ્રાય વધવા લાગ્યો. આથી યોગીજ મહારાજે ગામડે-ગામડે સત્સંગમંડળો સ્થાપ્યાં તથા તેમને પત્રવ્યાપી દ્વારા માર્ગદર્શન મળી રહે તેવી વ્યવસ્થા શરૂ કરી. આ ઉપરાંત તેમણે અનેક પ્રસંશનીય કાર્યો કર્યાં. બે વખત અભિલ ભારતદર્શન યાત્રા કાઢી. દરિબક્તોને તેઓ ડ્રેન દ્વારા યાત્રા કરાવતા. તીર્થો પાવન કર્યાં અને કેટલાય મુમુક્ષુઓને સત્સંગમાં ખેંચ્યા. દરિબક્તોને આશી કરીને, સરકારમાં ભલામણ કરીને છપૈયામાં 'છપૈયા સ્વામિનારાયણ' નામનું રેલવે સ્ટેશન શરૂ કરાવ્યું. યોગીજ મહારાજનું છપૈયામાં ભવ્ય સ્વાગત થયું હતું.

## શ્રદ્ધાંજલિ


**પૂ. દશરથભાઈ રાણા :** મોગરીમાં નિવાસ



કરતા અનુપમ સ્વજન દશરથભાઈ રાણા અચાનક આવી પડેલી ટૂંક સમયની બીમારીને અંતે ૧૯ એપ્રિલ ૨૦૨૫ના રોજ અક્ષરધામ સિધાવ્યા. કૃષ્ણમાં ભૂકુપ બાદ કૃષ્ણથી સ્થળાંતર થઈ મોગરીમાં રહેવા

આવ્યા અને સંતોનો યોગ દાતો તેથી અનુપમ ભિશનની સેવાકીય તથા સત્સંગની પ્રવૃત્તિમાં સંકિય થયા. વર્ષો સુધી શ્રી યોગી આરોય કેન્દ્રનું સફળ સંચાલન કરીને સંતોને દાશ અપાવે તેવી જવાબદારી નિભાવી ભક્તિ અદા કરી. તેઓનાં ધર્મપત્ની મીનાબહેન, પુત્ર વિકીભાઈ (યુ.એ.સ.એ.) અને દીકરી પલકબહેન (કનેડા) પણ સત્સંગમાં ઓતપ્રોત થયાં. સંતભગવંત સાહેબજી અને સદ્ગુરુ સંતોમાં અપાર વિશ્વાસ સેવનાર પરિવારનાં સૌને પ્રભુના કર્તાપણાની દફનિષા, તેથી દશરથભાઈના નિધનથી આવી પડેલ દુઃખના સમયમાં પણ સમતાથી રહી શક્યાં. ભક્તિના પાઠને જીવનમાં ઉતારનાર આવા ભક્તો આદર્શ છે. ગુરુહરિની પ્રસત્તાનાં પાત્રો સમા દશરથભાઈ રાણા અને પરિવારજનોની ભક્તિને વંદન ! દશરથભાઈ રાણાની સ્થળ વિદાય પ્રસંગે તેઓનો આત્મા સુગતિ પામી નવા જન્મે પ્રભુના જોગમાં રહી આત્માની પ્રગતિ સાથે તેવી પ્રાર્થના !

**પૂ. અંબાલાલભાઈ પટેલ :** અમદાવાદ



મંડળના જૂના સત્સંગી અને નિષાવાન અક્ષરમુક્ત પૂ. અંબાલાલભાઈ પટેલ ૨ મે ૨૦૨૫ના રોજ અક્ષરધામ સિધાવ્યા. તેઓને સંતભગવંત સાહેબજીનો યોગ થયો અને સત્સંગમાં ઓતપ્રોત થયા. સમગ્ર પરિવારને સત્સંગમાં જોડ્યો. સદગુરુ સાધુ પૂ. અશ્વિનદાદા સાથે જીવની પ્રીતિ કરી અને સાધુ પૂ. રજનીદાસજી, પૂ. ગૌતમદાસજી જેવા હિંદુ સંતો સાથે સતત સમાગમમાં રહી આત્માનું કલ્યાણ કરી લીધું. તેઓના દીકરા બિરેનભાઈને પણ સત્સંગની સેવા અને સંતો સાથેના સંબંધનો સંસ્કારવારસો આપ્યો. સદા નિયમિત રીતે સત્સંગ, સેવા અને સત્સંગસભામાં પ્રવૃત્ત રહીને ભક્તિનો આદર્શ પૂરો પાડનાર પૂ. અંબાલાલભાઈને વિદાયવેળાએ વંદન !

સ્વામીશ્રીનાં અદ્ભુત કાર્યોથી પ્રેરાઈને સૌ દરિબક્તોએ તેમની પાંસઠમી જન્મજયંતી સંવત ૨૦૧૨ના વૈશાખ વદ બારશના દિવસે સારંગપુરમાં ઊજવી. એક લાખ દરિબક્તોએ ભેગા થઈ યોગીજી મહારાજનાં પશોગાનગાયાં.

શાસ્ત્રીજી મહારાજના સંક્લય પ્રમાણે સંવત ૨૦૧૮માં તેમણે મુંબદીમાં મોટું ‘અક્ષરભવન’ સ્થાપ્યું. મહેણાવમાં ગુરુ શાસ્ત્રીજી મહારાજના જન્મસ્થાન પર સુંદર મંદિર કરાવ્યું અને મૂર્તિપ્રતિકા કરી. એમના ગુરુ શાસ્ત્રીજી મહારાજની આરસની પ્રતિમા પણ ત્યાં પદ્ધરાવી.

સંવત ૨૦૨૧ની સાલ આવી અને શાસ્ત્રીજી મહારાજને પ્રગટ થયાને સો વર્ષ થતાં હતાં. યોગીજી મહારાજની ૭૪ વર્ષની વૃદ્ધ અવસ્થા અને અસ્વસ્થ નાજુક તબિયત હોવા છતાં તે ઉત્સવ માટે શિળાયાની કડકડતી ટાઢમાં બત્રીસ દિવસમાં ૮૨ ગામડાંઓમાં પદ્ધરામણીઓ કરીને લાખો રૂપિયાની સેવા ભેગી કરી. આટાટલું કષ તેમણે પોતાના ગુરુ શાસ્ત્રીજી મહારાજની જન્મશતાબ્દી ઊજવવા માટે વેઠ્યું.

ત્યારબાદ પૃથ્વી પર સદ્વિદ્યાની પ્રવૃત્તિ વધે એ હેતુથી તેમણે વદ્વભવિદ્યાનગરમાં છાત્રાલય અને ગોંડલમાં ગુરુકુળની સ્થાપના કરી. ગોંડલમાં પ્રાથમિક અને માધ્યમિક શાળા પણ શરૂ કરાવી.

શાસ્ત્રીજી મહારાજ સંસ્થાપિત ‘સ્વામિનારાયણ પ્રકાશ’ સામાયિકનો પ્રસાર કરી ધેર-ધેર દરિબક્તોને વાંચતાં કર્યા. દ્વરેક કેન્દ્રમાં નિયમિત રવિવારની સભા ભરાય ને સત્સંગ સંબંધી માર્ગદર્શન ને સમાચાર મળી રહે એ હેતુથી ‘સ્વામિનારાયણ સત્સંગપત્રિકા’ નામની અઠવાડિક પત્રિકા બહાર પાડી.

યોગીજી મહારાજની મહત્ત્વાએ હતીકે જુદા જુદા દરેક ધર્મના આચાર્યો અને મહંતોને તેમને માટે આદર હતો. તેઓ યોગીજી મહારાજ પાસે આશીર્વાદ લેવા અને માર્ગદર્શન મેળવવા પદ્ધરાતા. એમનું કહેવું હતું કે, ‘યોગીજી મહારાજ સૌના છે. યોગીજી મહારાજ કાંઈ સ્વામિનારાયણ સંપ્રદાયના નાહિએ, પરંતુ સમગ્ર વિશ્વના નાહિએ.’

યોગીજી મહારાજે લાખો પરધર્મિઓને સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત બનાવ્યા છે. ગમે તે ધર્મ કે પંથનો માણસ દોય તેમના સંપર્કમાં આવે એટલે નમીજ પડે, સત્સંગીબની જ્ઞાય. તેમણે જૈન, શીખ, પારસી, મુસ્લિમ, આઙ્લિકાના નેટિવો, યુરોપિયનો વગેરે પરધર્મિઓ ને પરભાષીઓને માર્ગદર્શન આપ્યું છે અને સત્સંગમાં ઝેંચ્યા છે. યોગીજી મહારાજે નિઃસ્વાર્થભાવે ભગવાનની સેવા કરી અને સમગ્ર માનવજીતને સેવા અને ભક્તિનો ઉપદેશ આપ્યો. યોગીજી મહારાજનું સન્માન એટલે સમગ્ર માનવજીતના ઉદ્ઘારક ! આ સુચવે છે કે યોગીજી મહારાજનું વ્યક્તિત્વ કેટલું મહાન હતું ! માત્ર આપણા માટે જ નાહિએ, પરંતુ સમગ્ર વિશ્વ માટે યોગીજી મહારાજ પ્રેરણાદારી સ્વરૂપ છે.



# શ્રીહિંબજીની પદામણીની ધડીઓ એળિયામણી



૧ એપ્રિલ, મંગળવાર... બ્રહ્મજ્યોતિ પર નિજ મંદિરજીમાં સંદ્યા આરતીનાં દર્શન કરી, ધૂન-પ્રાર્થના કરી. ‘અક્ષરમહોલ’માં રાત્રિસભામાં અ.નિ. સદ્ગુરુ સાધુ પૂ. વિષ્ણુભાઈ (વી. એસ.)ના ૮૮મા પ્રાગટ્યાટિન અને ૧૦મી પુણ્યતિથિ પ્રસંગે તેઓના જીવન-માહાત્મ્યની અદ્ભુત વાતો કરી ઉપસ્થિત સૌને આશીર્વાદ પાઠયા.

૨-૩ એપ્રિલ, બુધ-ગુરુવાર... ‘અક્ષરમહોલ’માં સંદ્યા આરતી દર્શન કરી, ધૂન-પ્રાર્થના કરી તથા રાત્રિસભામાં પદારી આશીર્વાદ પાઠયા.

૪ એપ્રિલ, શુક્રવાર... મંદિરજીમાં સાંજે શ્રી દાકોરજીનાં દર્શન કરી, ધૂન-પ્રાર્થના કરી. ‘ઉપાસના’માં દરિધામ-સોખાથી પદારેલ પ.પૂ. પ્રેમસ્વરૂપ સ્વામીજી ને સંતોનાં સ્વાગત કરી ગોઢિનો લાભ આપ્યો.

૫ એપ્રિલ, શનિવાર... ડેન્ટલ ટ્રીટમેન્ટ માટે આણંદમાં ડૉ. સચીબહેન-ડો. અરુણભાઈ બત્રાના ‘સુંદર ક્લિનિક’માં પદાર્થા. રાજ્યભોગ આરતી બાદ ‘અક્ષરમહોલ’માં યોજેલ સભામાં પદારી આશીર્વાદ પાઠયા. સાંજે અમદાવાદમાં શ્રીમતી આનંદીબહેન (ગવર્નરશ્રી, ઉત્તર ભારત)નાં દીકરી અનારબહેન-જ્યેશભાઈ પટેલના ઘરે પદારી ગોઢિનો લાભ આપ્યો. એન.જી.ઓ.ની મુલાકાત લઈસ્થાનિક કર્મચારીઓને આશીર્વાદ આપ્યા.

૬ એપ્રિલ, રવિવાર... અનારબહેન-જ્યેશભાઈ પટેલના ઘરે શ્રી રામનવમી અને શ્રી દરિજ્યંતી નિમિતે ધૂન-પ્રાર્થના કરી. શ્રીમતી આનંદીબહેન સાથે તેઓના વતનના ગામ ખરોડ મુકામે જિણોદ્વાર થયેલા શ્રી રામ મંદિરમાં યોજેલ પ્રાણપ્રતિષ્ઠા મહોસ્વમાં પદારી આશીર્વાદ પાઠયા. યજ્ઞમાં બિરાજમાન સર્વે યજ્ઞમાનોને આશીર્વાદ આપ્યા. ત્યારબાદ મૂર્તિઓની પુનઃ પ્રાણપ્રતિષ્ઠા કરી, પ્રતિષ્ઠા આરતી અર્પણ કરી, સર્વે દેવ-દેવીઓનાં દર્શન કર્યાં. શ્રીમતી આનંદીબહેન સાથે સૌની વિદાય વર્ષ ગાંધીનગરમાં જ્યેશભાઈ જોશી-અંકિતાબહેનના ઘરે પદાર્થા, ત્યાં મંડળના સૌભક્તોએ સ્વાગત કર્યાં. સભામાં આશીર્વાદ આપી પરત બ્રહ્મજ્યોતિ પદાર્થા. શ્રી દરિજ્યંતી નિમિતે મંદિરજીના પ્રાંગણમાં યોજેલ સભામાં કીર્તનભક્તિનો આનંદ માણી, સૌથે ભેગાં મળી પ્રભુપ્રાગટ્યની આરતી અર્પણ કરી. ત્યારબાદ ઉપસ્થિત સૌંસંતો-ભક્તોને આશીર્વાદ આપ્યા.

૭ એપ્રિલ, સોમવાર... મંદિરજીમાં આરતી દર્શન કરી, ધૂન-પ્રાર્થના કર્યાં. બ્રહ્મસ્વરૂપ પ.પૂ. કાકાજી મહારાજ સ્મૃતિદિને મંદિરજીના પ્રાંગણમાં સાંજે યોજેલ કીર્તન આરાધનામાં પદારી કીર્તનભક્તિનો આનંદ માણ્યો. શ્રી કૃષ્ણ દોસ્પિટલ, કરમસદના ડૉ. ભાવેન્દુભાઈ વૈષ્ણવ તેમના દીકરા ડૉ. ઋતમનો એમ.બી.બી.એસ.નો અભ્યાસ પૂર્ણ થતાં પરિવાર સાથે દર્શને પદાર્થા, તેઓ સૌને આશીર્વાદ આપ્યા. લોસ ઓન્જલસ-અમેરિકા પરત પદારતાં જિતુભાઈ-મનીખાબહેનને આશીર્વાદ આપ્યા.

૮ એપ્રિલ, મંગળવાર... દર્શનાર્થે પદારેલ સોખડા ગામના સરપંચશ્રી રાજુભાઈને આશીર્વાદ પાઠયા. ‘અક્ષરમહોલ’માં સંદ્યા આરતીનાં દર્શન કર્યાં. નિજ મંદિરજીમાં દર્શન સાથે ધૂન-પ્રાર્થના કરી. ‘અક્ષરમહોલ’માં રાત્રિસભામાં પદારી આશીર્વાદ આપ્યા.

૯ એપ્રિલ, બુધવાર... સાંજે પ્રોસ્ટેટની સર્જરી માટે અમદાવાદ જતાં પહેલાં નિજ મંદિરજીમાં પદારી શ્રી દાકોરજીનાં દર્શન-પ્રાર્થના કર્યાં. ‘અક્ષરમહોલ’માં દર્શનાર્થે પદારેલ સૌંસંતો-ભક્તોને દર્શન-આશીર્વાદનું સુખ આપીને, ધૂન-પ્રાર્થના કરીને અમદાવાદ તરફ પ્રયાણ કર્યું. અમદાવાદ ‘ઉપાસના ધામ’ મંદિરે પદારી શ્રી દાકોરજી મહારાજનાં દર્શન કરી ભક્તોને દર્શન આપ્યાં. રાત્રે સારવાર માટે સદ્ગુરુ સાધુ પૂ. અચિનનદાદા અને ડૉ. પાર્થિવભાઈની ઉપસ્થિતિમાં ડૉ. જનકભાઈદેસાઈની ‘સામવેદ દોસ્પિટલ’માં દાખલ થયા.

૧૦ એપ્રિલ, ગુરુવાર... સવારે ધૂન-પ્રાર્થના કરી ડૉ. જનકભાઈ, ડૉ. ભરતભાઈ દવે, ડૉ. પાર્થિવભાઈ, ડૉ. જ્યેશભાઈ આદિની ઉપસ્થિતિમાં સર્જરીની પ્રોસેસ થઈ. સર્જરી બાદ ડોક્ટરોની સૂચના મુજબ બાપોરે સ્વાસ્થ્યલાભ માટે સારવાર પ્રામ કરી. સાંજે શ્રી ગુણાતીત જ્યોતનાં મહંતશ્રી લાડીલાં પ.પૂ. હંસાઈદી-સંત બહેનો સાથે આશીર્વાદ આપવા દોસ્પિટલ પદાર્થા.

૧૧થી ૧૩ એપ્રિલ, શુક્રથી રવિવાર... સ્વાસ્થ્યલાભ માટે દોસ્પિટલમાં ડોક્ટરની સૂચના મુજબ સારવાર પ્રામ કરી. સૌંસંત સંતો અને દોસ્પિટલનાં હેડ નર્સ પૂ. ઈલાબહેન, પૂ. કંચનભહેન (ગુણાતીત જ્યોત), સ્થાનિક ડોક્ટર્સ અને સમગ્ર સ્ટાફે ખૂબ સુંદર સેવાઓ અર્પણ કરી.

૧૪ એપ્રિલ, સોમવાર... ડૉ. જનકભાઈ ટેસાઈ અને તેમના ધર્મપત્ની ડૉ. શેષાલીબહેણની સેવા બહલ સમગ્ર હોસ્પિટલના સ્ટાફની ઉપસ્થિતિમાં તેઓનાં સંન્માન-અભિવાદન કર્યા તેમજ ડૉ. જનકભાઈને તેઓના જન્મદિવસની કેક અર્પણ કરી આશીર્વાદ પાઠવ્યા. સાંજે હોસ્પિટલમાંથી રજા વઈ ‘ઉપાસના ધામ’ શ્રી દાકોરજ મહારાજનાં દર્શનાર્થે પદ્ધાર્યા. શ્રી દાકોરજ મહારાજનો તેમજ ધૂન-પ્રાર્થના કરી તે માટે સૌ સંતો-ભક્તોનો હૃદયના ભાવથી આભાર વ્યક્ત કરી સૌને આશીર્વાદ પાઠવ્યા. સાંજે ‘ઉપાસના ધામ’થી નરસીદાસ, ચુનીભાઈ, ધનજીભાઈના ભાવને વશ થઈને બોપલ-‘ધૂનિટી’માં રોકાણ કરવા માટે પદ્ધાર્યા.

૧૪થી ૧૭ એપ્રિલ, સોમવારથી ગુરુવાર... ચાર દિવસનાં રોકાણ દરમિયાન ‘ધૂનિટી’માં સૌ પરિવારજનોને સત્યંગ-સમાગમનું સુખ આપ્યું. આ દરમિયાન નિત્ય રત્ને ડૉ. પાર્થિવભાઈએ સ્વાસ્થ્ય સારવાર માટે પદ્ધારી ભક્તિ અર્પણ કરી.

૧૮ એપ્રિલ, શુક્રવાર... સાંજે અમદાવાદ નરસીદાસ અને ‘ધૂનિટી’ પરિવારની વિદાય વઈ ‘ઉપાસના ધામ’ મંદિરે પદ્ધાર્યા. શ્રી દાકોરજ મહારાજનાં દર્શન કરી, સૌ ભક્તોને દર્શનનું સુખ આપી, રત્ને તપોભૂમિ બ્રહ્મજ્યોતિ, મોગરી પદ્ધાર્યા. મંદિરજીના પ્રાંગણમાં સૌ સંતો-ભક્તોએ સ્વાગતના સુંદર ભાવ અર્પણ કર્યા ત્યારે આતશબાજુના પ્રકાશ અને નાદથી આકાશ ગૂંજુ ઉછ્યું. નિજ મંદિરજીમાં શ્રી દાકોરજનાં દર્શન કરીને શ્યયન આરતીનો લાભ લીધો. ‘અક્ષરમહોલ’માં સ્વાગતસભામાં પદ્ધારેલ સૌ સંતો તેમજ સ્થાનિક મંડળના ભક્તોને દર્શન-આશીર્વાદનું સુખ આપ્યું અને તેઓના સઝણ આ૽પેશન બદલ સૌ ડોક્ટર્સની ટીમની સારવાર તેમજ ભક્તોની સુહૃદ પ્રાર્થના બદલ આભાર માન્યો.

૧૯ એપ્રિલ, શનિવાર... તપોભૂમિ બ્રહ્મજ્યોતિ પર ‘ઉપાસના’ નિવાસસ્થાને સ્વાસ્થ્યલાભ માટે આરામકર્યો.

૨૦ એપ્રિલ, રવિવાર... મોગરી સ્થિત અનુપમ સ્વજન દશરથભાઈ રાણા અક્ષરધામમાં પદ્ધાર્યા દોવાથી તેમનાં પત્ની મીનાબહેન, દીકરા વિકીભાઈ, દીકરી પલકબહેન તથા પરિવારજનોની સ્વસ્થતા માટે પ્રાર્થના કરી, આશીર્વાદ પાઠવીને સાંત્વન આપ્યું. ‘ॐ યોગ ગ્રુપ’ના ભક્તોએ દર રવિવારે પણશાળામાં થતા યજના યજમાન બની ભાગ લીધો. ત્યારબાદ સૌએ ‘ઉપાસના’ના પ્રાંગણ ‘સામીય’માં પદ્ધારી દર્શન-આશીર્વાદનું સુખ પ્રાપ્ત કર્યું.

૨૧ એપ્રિલ, સોમવાર... દુબઈથી દર્શનાર્થે પદ્ધારેલ યોગેશભાઈ દોશી અને તેઓનાં ધર્મપત્નીને આશીર્વાદ પાઠવ્યા.



૨૨ એપ્રિલ, મંગળવાર... ‘ઉપાસના’ નિવાસસ્થાને સ્વાસ્થ્યલાભ માટે આરામકર્યો.

૨૩ એપ્રિલ, બુધવાર... ‘ઉપાસના’ નિવાસસ્થાને સ્વાસ્થ્યલાભ માટે આરામ કર્યો તેમજ દર્શનાર્થે પદ્ધારેલ ભક્તોને દર્શન-આશીર્વાદનો લાભ આપ્યો.

૨૪ એપ્રિલ, ગુરુવાર... શ્રી ભીખુભાઈ પટેલ (ચેરમેનશ્રી, ચારુતર વિદ્યામંડળ), શ્રી નિરંજનભાઈ (કુલપતિશ્રી, સરદાર પટેલ યુનિવર્સિટી), શ્રી ભુરાભાઈ આયર, શ્રી ડી. સી. પટેલ (સંકેત સેવ્સ) આદિ સૌ ખાસ દર્શનાર્થે પદ્ધાર્યા, તેઓને મુલાકાત આપી ગોણિનો લાભ આપ્યો.

૨૫ એપ્રિલ, શુક્રવાર... સાંજે મંદિરજીમાં આરતી દર્શન કરી, ધૂન-પ્રાર્થના કરી રાત્રિસભામાં પદ્ધારી ‘વચનામૃત ગ. મ. પ૪ સમજાવ્યું અને પૂ. અશ્વિનદાદા ને સંતો મુંબઈ-ભારઘર મંદિરના પાટોત્સવમાં પદ્ધારતા દોવાથી તેઓ સૌને આશીર્વાદ પાઠવ્યા.

૨૬ એપ્રિલ, શનિવાર... યુ.એસ.એ.થી પદ્ધારેલ દિલીપભાઈ (ગાના) તેમજ જી.એસ.ટી. કમિશર શ્રીમતી મનપ્રીતબહેન કોરને સત્કારી આશીર્વાદ પાઠવ્યા.

૨૭ એપ્રિલ, રવિવાર... મોરબી નિવાસી ભરતભાઈ અમૃતિયા-રંજનબહેનની દીકરી ચિ. ખુશી-ચિ. અત્રેયનાં લગ્નની કંકોતરીનું પૂજન કરી, મૂર્તિ અર્પણ કરી આશીર્વાદ પાઠવ્યા. તેજસભાઈ-કૃપાબહેન, કૌશલભાઈ-મેધાવીબહેન અને નીલામાસી આદિને સપરિવાર દર્શન-આશીર્વાદ આપ્યાં. સાંજે મંદિરજીમાં આરતી દર્શન કરી, ધૂન-પ્રાર્થના કરી અને ‘અક્ષરમહોલ’માં રાત્રિસભામાં પદ્ધારી આશીર્વાદ પાઠવ્યા.

૨૮ એપ્રિલ, સોમવાર... સાંજે શ્રી દાકોરજનાં દર્શન કરી, ધૂન-પ્રાર્થના કરી અને રાત્રિસભામાં આશીર્વાદ આપ્યા. મુંબઈ-ભારઘર મંદિરના પાટોત્સવમાં પદ્ધારતા સદ્ગુરુ સાધુ પૂ. મનોજદાસજી અને સંતોને આશીર્વાદ પાઠવ્યા.

૨૯ એપ્રિલ, મંગળવાર... ‘ઉપાસના’માં દર્શનાર્થે પદ્ધારેલ ભક્તોને દર્શન-આશીર્વાદનું સુખ આપ્યું.

૩૦ એપ્રિલ, બુધવાર... મંદિરજીમાં શ્રી દાકોરજનાં દર્શન કરી, ધૂન-પ્રાર્થના કરી ‘અક્ષરમહોલ’માં રાત્રિસભામાં યુ.કે. ધર્મયાત્રાએ પદ્ધારતા વહીલ સાધુ પૂ. દિલીપદાસજી અને અનુપમ સ્વજન યોગેન્દ્રભાઈને વિદાયની શુલેચ્છાઓ આપી સભામાં પદ્ધારેલ સૌ સંતો-ભક્તોને આશીર્વાદ આપ્યા.

# સત્ત્વા/સમાચાર

## માથાસૂરિયા મંદિરનો આઠ્મો પાટોત્સવ

વર્ષ ૨૦૧૭ની શ્રી હરિજયંતીના મહામંગળકારી દિને ભવ્ય ઉત્સવ સાથે માથાસૂરિયા ગામે મંદિરજીમાં સંતભગવંત સાહેબજી અને સદ્ગુરુ સંતોઓ મૂર્તિઓની ગ્રાણપ્રતિષ્ઠા કરી, તે મૂર્તિઓનો એ પાટોત્સવ સદ્ગુરુ સાધુ પૂર્ણ અસણાદા અને સંતોની દિલ્ય સન્નિધિમાં ૧૫ એપ્રિલના રોજ ભક્તિભાવે ઉજવાયો. આ પ્રસંગે બ્રહ્મજ્યોતિઃ, મોગરીથી સાધુ પૂર્ણ પંકજદાસજી અને માણાવદરથી સાધુ પૂર્ણ અશોકદાસજીએ પદારી દિલ્ય પાટોત્સવ પૂજા કરાવી, જેમાં સ્થાનિક ભક્તોએ યજ્ઞમાનપદે બિરાજ પાટોત્સવ પૂજાનવિધિમાં સંમિલિત થઈ સુંદર લાભ લીધો અને ભેગા મળીને ખૂબ સેવાઓ કરી આનંદ માણ્યો સાધુ પૂર્ણ પંકજદાસજીએ કથાવાર્તા અને સમાગમનું સુંદર સુખ આપ્યું. સદ્ગુરુ સાધુ પૂર્ણ અસણાદાએ આશીર્વાદ પ્રદાન કરી સૌની સેવાને બિરદાવી, ત્યારબાદ સંતોએ સાત હિવસના સૌરાષ્ટ્ર પ્રદેશના વિચારણમાં પદારી ભક્તોને સત્સંગનું અલોકિક સુખ પ્રદાન કર્યું.

## અમદાવાદમાં સંતભગવંત સાહેબજી પ્રાગટ્ય ઉત્સવ

અનુપમ મિશન, અમદાવાદ સત્ત્વાનું પ્રદેશ દ્વારા સંતભગવંત સાહેબજીના એ દમા પ્રાગટ્યોત્સવની ભવ્ય ઉજવણી ૨૦ એપ્રિલ ૨૦૨૫, રવિવારના રોજ સાંજે ચંચળ પાર્ટી પ્લોટ-વાસણા ખાતે કરવામાં આવી. સદ્ગુરુ સાધુ પૂર્ણ અશ્વિનાદા તથા બ્રહ્મજ્યોતિથી પદારેલા સંતો ઉપરાંત વિવિધ મંડળોમાંથી પદારેલા ભક્તો અને મહાનુભાવોનાં દિલ્ય સાંનિધ્યે ભવ્ય સત્ત્વાના અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે અક્ષરમુક્ત પંકજભાઈ

પટેલ (ચંચળ પાર્ટી પ્લોટ), શ્રી શૈલેશભાઈ પરમાર (ગુજરાત વિધાનસભાના ડેઝુટી લીડર, ધારાસભ્યશ્રી, દાણીલીમાડા-અમદાવાદ) અને શ્રી બળદેવભાઈ લુણી (ગુજરાત પ્રદેશ કેંદ્રેસના મહામંત્રીશ્રી), શ્રી બિમલભાઈ શાહ (પૂર્વ મિનિસ્ટરશ્રી), અનુપમ મિશનના અગ્રણીઓ નરસીંહાદા, શંકરકાકા (વડોદરા), ડૉ. પાર્વિલભાઈ મહેતા આદિ મહાનુભાવોપણ ઉપસ્થિત રહ્યા.

સાંસ્કૃતિક કાર્યક્રમમાં બાળમંડળ અને યુવક મંડળો બોધપ્રદાન નાટક અને યુવતી મંડળ દ્વારા ભાવનૃત્ય રજૂ થયાં. બાળમંડળો નાટકમાં ‘બાળસભા દ્વારા જીવનધારતર’ અને યુવક મંડળો ‘ગુરુઆજાનું પાલન એ જ સાચું ગુરુર્ધર્શન’ અને ‘સંયમ સહિતનું સોશિયલ મીડિયા’ની ખૂબ મનોરંજક અને હદ્યસ્પર્શીરજૂઆત કરી.

પંકજભાઈ પટેલે ખૂબ મહિમાધી તેમના ચંચળ પાર્ટી પ્લોટ ખાતે સધળાં આયોજન કરવામાં ખૂબ ઉત્સાહપૂર્વક રસાલીધો, તેઓનું વિશેષ



સન્માન કરવામાં આવ્યું. ત્યારબાદ પૂર્ણ અશ્વિનાદાએ સંતભગવંત સાહેબજીના અપરં પાર મહિમાનું દર્શન કરાવી સૌને આશીર્વાદ આપ્યા. અમદાવાદના સ્થાનિક ભક્તો તથા સાહંબા, દહેગામ, વલ્લભવિદ્યાનગર, વડોદરા, વેમાર અને સુરતથી લગભગ ૭૦૦થી વધુ ભક્તો પદાર્થા અને સત્ત્વાના સાંસ્કૃતિક કાર્યક્રમ અને મહાપ્રસાદનો લાભ લીધો.



ઉપાસના ધાર્મ, અમદાવાદ મંદિરે સંતભગવંત સાહેબજીના એ દમા પ્રાગટ્ય ઉત્સવ પ્રસંગે યુવાનો-યુવતીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વીપી ભક્તિ અર્પણ

## ઉપાસના ધામ, ખારઘર મંદિરની મૂર્તિઓનો ૧૮મો પાટોત્સવ

સંતભગવંત સાહેબજીની પ્રેરણા અને આશીર્વાદથી નિર્મિત નવી મુંબઈ-ખારઘરના ઉપાસના ધામ સ્થિત શ્રી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિરની મૂર્તિઓના ૧૮મા પાટોત્સવ નિમિત્તે ૨૬ એપ્રિલ ૨૦૨૫ના રોજ સદ્ગુરુ સાધુ પૂ. અશ્વિનદાદા સંતો સાથે મુંબઈ પદ્ધાર્યા અને ત્રણ દિવસ મુંબઈમાં વિચરણ કરીને તથા મંદિરે સભાઓમાં અદ્ભુત સત્યંગલાભ પ્રદાન કર્યા. ૨૬ એપ્રિલના રોજ સદ્ગુરુ સાધુ પૂ. મનોજદાસજી તથા સંતો પણ સંતભગવંત સાહેબજીની આજ્ઞાથી આ ઉત્સવમાં સહભાગી બની સૌને દર્શન-સમાગમનો લાભ આપવા પદ્ધાર્યા. સૌ ભક્તોએ ઉત્સાહથી સંતોનાં ભવ્ય સ્વાગત કર્યા. સાંજે સ્વાગતસભામાં મોટી સંખ્યામાં ભક્તો પદ્ધાર્યા અને દીકરા-દીકરીઓએ સ્વાગત ભજન પર નૃત્યભક્તિ અર્પણ કરી. તેમજ મુંબઈ પ્રદેશનાં ભાઈઓ-બહેનોએ પ્રાર્થના રૂપી ભાવ ધર્યા. સદ્ગુરુ સંતોએ આશીર્વાદ વરસાવી સૌને ધન્ય કર્યા.

૩૦ એપ્રિલ ૨૦૨૫ના રોજ સવારે ‘શ્રી ગુરુ આજ્ઞા મહિમા પર્વ’ની ઉજવણી ઉપક્રમે મુંબઈ મંડળના અક્ષરમુક્તો-બ્રિજભાઈ, ધૈર્ય તેજસભાઈ પટેલ, ડૉ. પદ્મવીબહેન ભિરુડ તથા જ્યોતસનાબહેન દેસાઈએ ગુરુ આજ્ઞા પાળવાથી જીવનમાં આવેલ લક્ષરાત્મક પરિવર્તનની હૃદયસ્પર્શી વાતો કરી. ત્યારબાદ પૂ. મનોજદાસજીએ અદ્ભુત આશીર્વાદ વરસાચ્યા અને સંધ્યા આરતીમાં નિત્ય ગવાતા ગોડી પદ-‘સંત સમાગમ કીજે’ની સમજણ આપી. સંધ્યા આરતી બાદ સ્થાનિક અક્ષરમુક્ત નેચરભાઈ દ્વારા આયોજિત કીર્તનવંદનાનો સૌથે આનંદ માણ્યો. વિખ્યાત કલાકાર રેખાબહેન વાળા દ્વારા આ ભક્તિ અર્પણ કરાઈ. તેમની સાથે અનુપમ ભક્તો અમિતભાઈ ઠક્કર, દીમિબહેન દેસાઈ અને ધૂતિબહેન તથા જ્યેશભાઈ ગાંધી અને પ્રીતિબહેન ગાંધી દ્વારા પણ ભજન-ભક્તિનું રસપાન કરાવાયું.

૧ મે ૨૦૨૫ના રોજ મંદિરજીના ગર્ભગૃહમાં બિરાજમાન શ્રી મુક્ત-અક્ષર-પુરુષોત્તમ મહારાજ સહિત સૌ સ્વરૂપોના ૧૮મા પાટોત્સવની વિધિ ખૂબ જ ભવ્ય અને હૃદયસ્થ સદ્ગુરુ સંત પૂ. શાંતિદાદાની સુમૃતિ સાથે શાલ્કોકતવિધિ તથા શ્લોકનાં ગાન દ્વારા સંતો દ્વારા કરવામાં આવી. ગર્ભગૃહમાં સદ્ગુરુ સંતો, વડીલ સંતો દ્વારા પૂજન-અર્થન કરવામાં આવ્યાં. પાટોત્સવ વિધિમાં આમંત્રિત અક્ષરમુક્તો તથા મુંબઈ પ્રદેશના અક્ષરમુક્તો સહિત ૨૮ ભક્તોએ યજમાનપદે બિરાજ ધન્યતા પ્રામણ કરી.

સદ્ગુરુ સાધુ પૂ. મનોજદાસજીએ આશીર્વાદ આપતાં ગુરુહરિ સાહેબજી મહારાજે આપેલ દ આજાને જીવનમાં અમલમાં મૂકવાની વાત

ટેકનોલોજીનાં દસ્તાંત આપીને કરી. ત્યારબાદ સદ્ગુરુ સંતો-ભક્તોએ શ્રી ઠાકોરજીને પાટોત્સવ આરતી અર્પણ કરી અને શ્રી ઠાકોરજી અને સ્વરૂપોને ૧૬ જેટલાં બંજનોનો અત્રફૂટ અર્પણ કર્યો. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોનાં સત્કાર-સ્વાગત કરાયાં. સભામાં પૂ. અશ્વિનદાદાએ આશીર્વાદ કરી સૌને મહિમામાં રહી ગુરુઆજ્ઞા પ્રમાણે જીવન જીવવાની સમજ આપી. ઈસ્કોન મંદિર, ખારઘરના સ્થાપક, ટ્રસ્ટી અને પ્રમુખ પૂ. સૂરદાસ પ્રભુજી આ પ્રસંગે પદ્ધાર્યા અને આશીર્વાદ પ્રદાન કર્યા.

સાંજે અનુપમ સૂરવું દના સંતો-ભક્તોએ પાટોત્સવ નિમિત્તે કીર્તનગાન કરી ભક્તિ અર્પણ કરી ભક્તોને બ્રતાનંદ કરાયો. સંતોનાં સાંનિધ્યે અને માર્ગદર્શને સ્થાનિક ભક્તોએ અદ્ભુત સેવાઓ કરી, સંતોનાં સમાગમનો લાભ પામી સૌધન્ય થયાં. ◆

### યોગી વિદ્યાપીઠનાં ગૌરવ

સંતભગવંત સાહેબજીની કૃપાશિષ અને પ્રેરણાથી સંસ્કારસંપત્ત શિક્ષણ અને કેળવણી આપતી યોગી વિદ્યાપીઠની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓનાં ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની બોર્ડની પરીક્ષાઓમાં જળણતાં પરિણામ આવ્યાં છે.

\* શાનયજ વિદ્યાલય-મોગરી : ધોરણ-૧૦ની બોર્ડની પરીક્ષાનું ૮૮.૩૦% પરિણામ આવ્યું છે, જેમાં ૧૫ વિદ્યાર્થીઓ A1 ગ્રેડ, ૩૨ વિદ્યાર્થીઓ A2 ગ્રેડ તથા ૩૩ વિદ્યાર્થીઓ B1 ગ્રેડ સાથે ઉત્તીર્ણ થયાં છે. ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહની બોર્ડની પરીક્ષાનું ૧૦૦% પરિણામ આવ્યું છે, જેમાં ૧ વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ તથા ૮ વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવી આણંદ જિલ્લામાં આગામું સ્થાન દાંસલ કર્યું છે.

\* શારદા મંદિર-નડિયાદ : ધોરણ-૧૦ની બોર્ડની પરીક્ષાનું ૮૬.૮૩% પરિણામ આવ્યું છે, જેમાં શાળાના ૪૨ વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ અને ૫૪ વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ દાંસલ કરી સુંદર સિદ્ધ મેળવી છે. ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહની બોર્ડની પરીક્ષાનું ૮૬.૮૮% અને સામાન્ય પ્રવાહની બોર્ડની પરીક્ષાનું ૮૮.૪૧% પરિણામ આવ્યું છે.

\* નીલકંઠવણી વિદ્યાલય : કચ્છ-શિણાય ખાતે અનુપમ મિશન સંચાલિત નીલકંઠવણી વિદ્યાલયના ધોરણ-૧૦ની બોર્ડની પરીક્ષાનું ૧૦૦% પરિણામ આવ્યું છે.

\* ધારી : શ્રીમતી વી. પી. જી. ગલ્વસ હાઈસ્ક્વલનું ધોરણ-૧૦ની બોર્ડની પરીક્ષાનું ૭૨.૭૬% પરિણામ આવ્યું છે.

સંતભગવંત સાહેબજીએ સૌ વિદ્યાર્થીઓ અને સારસ્વતગણને અંતરની શુભેચ્છાઓ પાઠવી પ્રસતતાપૂર્ણ આશીર્વાદ પ્રદાન કર્યા. ◆



ઉપાસના ધાર્મ, અમદાવાદ ખાતે યોજિત સંતલભગવંત સાહેબજીના ટ્રફ્મા પ્રાગટ્યવર્પર્વની ઉજવણીમાં મંચરથી સહયોગ કરું સાથે પૂ. અચિનનદા અને મળનભાવો



મુંબઈ-ખારઘર મંદિરમાં મૂર્તિઓની પાટોત્સવ પૂજન વિધિ કરતા સંતો



પાટોત્સવ આરતી અર્પણ કરતા સંતો અને યજમાન અક્ષરમુક્તાં



ઇસ્કોન મંહિર, ખારધરના પ્રમુખ પુ. સૂરદાસ પ્રભુજીના સન્માન અને આશીર્વાદ



A portrait of a smiling man with grey hair and a tilak on his forehead, wearing a light blue button-down shirt. He is positioned behind a silver microphone. In the background, a red rectangular sign with the white text "प्रवेश" (Pravesh) is mounted on a wall. The entire image is framed by a decorative border featuring a repeating pattern of red flowers.



પાટોત્સવ સભામાં સદ્ગુરુ સંતો દ્વારા આશિષવર્ષી



મંબઈ-ખારઘર મંદિરના પાટોત્સવ પ્રસંગે પધારેલ સંતોનાં તપોભૂમિ બ્રહ્મજ્યોતિમાં સ્વાગત



સાહેબજીના દર્શનાર્થે પધારેલ અગ્રાહી ઉદ્યોગપતિ, સમાજસેવક શ્રી પ્રવીણભાઈ કોટક

# Invitation

Swaminarayan Mandir  
Dashabdi Mahotsav

Guru Aagna Mahima Parva

Sarvopari Upasana Sopan

**13 - 17 August 2025**



THE LEA, WESTERN AVENUE,  
DENHAM, UXBRIDGE UB9 4NA

10  
MANDIRJI  
DASHABDI  
MAHOTSAV UK AUG 2025



## Anoopam Mission


is delighted to welcome you to the grand celebrations of the auspicious Mandir Dashabdi Mahotsav! We look forward to celebrating 10 years of the Mandirji and Shri Thakorji's divine presence, under the sacred umbrella of 'Guru Aagna Mahima Parva' and 'Sarvopari Upasana Sopan' in the divine presence of

### Guruharji Sant Bhagwant Sahebjee

It would be our utmost privilege and pleasure to have you with us, as we enjoy and celebrate the manifest grace of Guruharji Sahebjee in our lives.

## PROGRAMME OF EVENTS

**AUGUST 2025 Wed 13**



**Thurs 14**

**Fri 15**

**Sat 16**

**Sun 17**

<b>5.00 pm - 6.30 pm</b> <b>8.00 pm</b>	Dashabdi Mahotsav Opening Ceremony Dashabdi Mahotsav Cultural Programme
<b>10.00 am - 12.30 pm</b> <b>5.00 pm - 6.30 pm</b> <b>8.00 pm - 9.30 pm</b>	Sarvopari Upasana Sabha Param Puja Ashvindada Jivan Mahatmya Darshan Param Puja Shantidada Jivan Mahatmya Darshan
<b>9.30 am - 12.30 pm</b> <b>5.00 pm - 6.30 pm</b> <b>8.00 pm - 10.00 pm</b>	Mandirji Dashabdi Mahotsav Mahayagna India Independence Day Celebrations & Flag Raising Kirtan Sandhya
<b>9.00 am - 10.30 am</b> <b>11.00 am - 12.30 pm</b> <b>5.00 pm - 6.30 pm</b> <b>8.00 pm - 10.00 pm</b>	Shri Thakorji 10 <sup>th</sup> Patotsav Ceremony Dashabdi Patotsav Sabha Guru Aagna Mahima Sabha Kirtans and Garba
<b>10.00 am - 12.30 pm</b>	Puja Himat Swami Pragtyadin Celebrations & Closing Ceremony

*Mahaprasad will be served throughout these events  
and we look forward to welcoming you!*

*Jai Shri Swaminarayan!*



**Regd. News Paper / Air Mail / Book Post**

Brahmanirzar Monthly R.N.I. New Delhi No.: 69476/86 \* Po. Regd. No. AND/303/2024-26

\* Date of Publication : 14<sup>th</sup> of each Month

\* Date of Posting : 15<sup>th</sup> of each Month \* Posted at: Vallabh Vidhyanagar Post Office

"Brahmanirzar" Monthly Postal Reg. No. RO - VDR/AND - 303 \* Date of Dispatch : 15-5-2025 \* Office of Origin : Vallabh vidhyanagar

Founder Editor : Shantibhai F. Patel \* Editor : Sandipbhai R. Shah

Published by : Dilipbhai V. Desai on behalf of Anoopam Mission. \* Published at : Mogri 388 345, Gujarat

Printed by : Pradip S. Giri \* Printed at : Prizam Printers and Publishers Ltd., Amdavad 380 008

**If Undelivered Please return to :**

Anoopam Mission, Brahmajyoti, Yogiji Marg, Mogri-388 345, Dist. Anand,

Gujarat, India \* Phone : (02692) 230483, 230544

email : amindia@anoopam.org \* website: www.anoopam.org

To,